



ગ્રીબા ૨૦૦૫

વિંગ

પક્ષીનિરીક્ષકો પરંપરાનો જ્ઞાતુ



પચામર્શક : લાલસિંહ રાઓલ

સંપાદક : ડૉ. બનુલ મિશેની



વરસો પહેલાની વાત છે. સાંજના ફરવા નીકળેલો. એક અવાવરુ કુવાની પાળે બેસી થાક ઉતારતો હતો. કુવામાં અધ્યવચ્ચે એક તાર બાંધેલો હતો. એક ચકલી તે તાર પર બેઠી હતી. થોડી વારમાં એક ચકલો આવીને કુવાની પાળ પર બેઠો. નીચે તાર પરની ચકલી તેની નજરે પડી. ઉડીને તેની પાસે ગયો. અચાનક જ તેણે ચકલી સાથે પાંખરવાનો (mating) પ્રયત્ન કર્યો. ચકલી તે માટે બિલહુલ તૈયાર ન હતી. તેણે ચકલાને જરાય મચક ન આપી. પોતાની ઉપર બેસવા જ ન દે. તેમ છતાં ચકલાએ પ્રયત્ન ચાલુ રાખ્યા. છેવટે તેને અધકયરી સફળતા મળી. પછી જેવો કુવાની બહાર જવા તે ઉડ્યો કે ચકલીએ તેને (પાઈ ભણાવવા!) પકડવા માટે જાતું માર્યું. ચકલાની પાંખનો છેણો ચકલીની ચાંચમાં પકડાઈ ગયો. ચકલો હવામાં લટકવા લાગ્યો. તેમાંથી છૂટવા ચીંચીકાર કરવા માંડ્યો, પણ ચકલીએ તેને ન છોડ્યો, એટલું જ નહીં, પોતાની ડોક ડાબાજમણી હલાલીને ચકલાને જોલા ખવરાયા. ચકલીની પકડમાંથી છૂટવા ચીસો પાડતો રહી તે પાંખ ફફડાવવા લાગ્યો.

ચકલીએ ચાર-પાંચ જોલા તેને ખવરાયા હશે. એટલામાં તેણે પકડેલ ચકલાની પાંખનું પીઠું છુંટું પડી ગયું. મુક્તિ મળતાં જ ચકલો જે જરૂરે ભાગયો તે જોઈ હસવું આવ્યું.

આ બનાવ જોઈ વિચારો આવ્યા. યુગલ તરીકે જોડાયેલા ચકલાઓમાં પાંખરવા માટેના નરના દરેક પ્રયત્નનો માદા હક્કારાત્મક પ્રતિભાવ આપે જ એંટું નથી બનતું, પણ આ કિસ્સામાં ચકલીની વર્તણૂક વિચિત્ર લાગ્યી. માની લઈએ કે ચકલાની પાંખ અક્ષમાતે જ પકડાઈ ગઈ. તો પછી તેને છોડી ઢેવાને બદલે ચકલીએ ચારપાંચ જોલા કેમ ખવરાયા? ચકલો તેનો કાયદેસરનો (!) નર નહીં હોય? આપણી ભાષામાં કહીએ તો રસ્તે રખડતો રોમિયો હશે? ચકલી તેના ઉપર ગુસ્સે થઈ હશે? તેને પાઈ ભણાવવા જોલા ખવરાયા હશે? આવા માનવીય ભાવો પંખીઓ ઉપર આરોપવાનું યોગ્ય ગણાય ખરું?

સી-૨, હારિઓમ એપાર્ટ., 'ટાઇસ એફ ઇન્ડિયા' પ્રેસ રોડ, અવરાજ પાર્ક, અમદાવાદ-૫૧



દશકુપસમો વાપી, દશવાપીસમો હૃદ |

દશહૃદસમો પુત્ર, દશપુત્રસમો દ્રુમ ||

(મત્સ્યપુરાણ ૫૧૨)

દસ કુવા બરાબર એક વાવ, દસ વાવ બરાબર એક તળાવ,

દસ તળાવ બરાબર એક પુત્ર, દસ પુત્ર બરાબર એક વૃક્ષ.

(મત્સ્યપુરાણ ૫૧૨)

સાલાના રવિલાલ

ક્ષાય ફોરેસ્ટ યુથ ક્લબ, કેશોદ	૧૫૦૦-૦૦	દર્શન જરદીશ, સુરત	૧૦૦-૦૦	નેચર ક્લબ, જોથપુર, અમદાવાદ	૧૦૦-૦૦
નૌક તાતીમ કેન્દ્ર, વડોદરા	૫૦૦-૦૦	વિરલ પ્રજ્ઞપતિ, સુરત	૧૦૦-૦૦	પરાગ પારાશર્ય, ભાવનગર	૧૦૦-૦૦
ભવભૂત પારાશર્ય, આસ્થાંદ	૫૦૦-૦૦	ગંભીરસિંહ ગેહિલ, ભાવનગર	૧૦૦-૦૦	જગહીશસિંહ જોણા, રાજકોટ	૧૦૦-૦૦
ઉદ્ય વોરા, ગાંધીનગર	૩૦૦-૦૦	ઉદ્યોગ રાણ, અમદાવાદ	૧૦૦-૦૦	હિરેન સોની, આસ્થાંદ	૧૦૦-૦૦
એ.કે.ડેસાઈ, ભરૂય	૨૦૦-૦૦	ઉધકાના પેટેલ, અમદાવાદ	૧૦૦-૦૦	નિર્મણ શુક્ક, રાજકોટ	૧૦૦-૦૦
જયસિંહ પરમાર, લુજ	૨૦૦-૦૦	કે.વી.પારેખ, મહુવા	૧૦૦-૦૦	હસમુખ શાહ, અમદાવાદ	૫૦-૦૦
સુભાગ ગંભા, જીમનગર	૧૦૦-૦૦				

સૂચિ



શ્રોક પ્રક્રિ	૨
વિહંગાવલોડન	૩
નિર્જિષ્ઠા નોંધ	૫
ગીય પર જાપતો	૧૧
નારકસ બોથ	૨૫
પઅદોતુ	૨૮
મ.કુ.હિમતકણાણની હલમે	૨૭

મુખ્યપૃષ્ઠ

ટપકીલી નાચણ
તસવીરકાર : કોહિત વ્યાસ



વિહંગ

વર્ષ-૮ વર્ષાંગ અંક ૨૪ ચીજું ૨૦૦૫

પરામર્શક સંપાદક
લાલસિંહ રાઓલ ડૉ. બહુલ ત્રિવેદી
સંપાદક મંડળ
પી.એસ.ટક્કર, ડૉ. આર.બી.બલર, કે.ડી.વેણુવ
પત્રવધાર
૧૬/૪૧૪, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ,
અમદાવાદ-૩૮૦૦૧૫

E mail : vihangujarat@yahoo.co.in

સૈચિક્કલ લવાજમ : વાર્ષિક રૂ. ૧૦૦-૦૦
(શુલેશ્વર કાળો આવકાર્ય -

'વિહંગ' ના નામે ચેક / ડ્રાઇટ અથવા મ.એ.થી.)

પ્રકાશક : લાલસિંહ રાઓલ, સી-૨, હરિઓમ
એપાર્ટમેન્ટ, ટાઈસ ઓફ ટાઈપા પ્રેસ રોડ,
જીવરાજ પાર્ક, અમદાવાદ-૩૮૦૦૫૧.

મુદ્રક : ડૉ. બહુલ ત્રિવેદી, મુદ્રાસ્થાન : 'શારદ
પ્રકાશન', પ, સનપોઈન્ટ ગોમલેખ, ગુરુકુણ સમે,
અમદાવાદ-૩૮૦૦૫૨.

કંપાદકીય



હું આ લખી રહ્યો હું ત્યારે વસંતનો
વાયરો મારા રોમેરોમને સ્પર્શી રહ્યો છે. મારા
'કંપાઉન્ડ'માં સમપર્વતીના દસ મીટર ઊંચા વૃક્ષની ટોચ ઉપર સમયી
તેનાં બચ્ચાને ઉછેરી રહી છે. ખાખરો, કેસુડાનાં ફૂલાથી સુશોભિત
થઈ ચૂક્યો છે. વસંત સૌની રેગરગમાં જાણે વહી રહી છે. દિવસના
કોઈ પણ ભાગમાં સમય મળે તો હું હિંચકે ઝુલતા ઝુલતા વસંતનો
વાયરો જીલવાનું ચૂક્તો નથી. વૃક્ષોની ઘટામાંથી ચળાઈને આવતો
બપોરનો તડકો પણ આઢાદક લાગે છે.

જતુઅને જતુઅને પ્રકૃતિનો બદલાતો સ્પર્શ માણવા વૃક્ષની નીચે
તો બેસનું જ પડે. નિસર્જના વૈવિધ્યપૂર્ણ સૌંદર્યને વૃક્ષથી વિશેષ કોણ
છતું કરી શકે? વૃક્ષ, કુદરતની શાશ્વત સુંદરતાનું પ્રતિક છે. કુદરતની
સાથે ઓતપ્રોત થવા માટે વૃક્ષ સાથેનું તાદાત્ય મને સૌથી સરળ
માધ્યમ લાગ્યું છે. પવનની લહેરખી સાથે તોલતાં પક્ષો અને તેની
ઘટામાં આમથી તેમ ઊડાડિ કરતાં પંખીઓ, શિખાવિન્યાસની અનોખી
દ્વારા અને અદ્ભુત શિલ્પ સાથા થઈ એકિટરો નિરખ્યા કરવાનું, તેનાથી
વિશેષ સમાધિ મને બીજી કોઈ લાગી નથી. વૃક્ષનું જતન એટલે પ્રકૃતિનું
જતન. જંગલનાં વૃક્ષો હોય, દરિયાકિનારાનાં ચેરનાં વૃક્ષો હોય કે
શહેરી વિસ્તારના રસ્તાઓની બાજુમાં વાવેલાં વૃક્ષો હોય, સૌંનું મહત્વ
જે તે જગ્યાએ અમૂલ્ય છે.

પ્રકૃતિ અને પક્ષી-સંરક્ષણ અંગે જેમ વધુ વિચારીએ તેમ એ
વિચારનો વળ વૃક્ષ પાસે આવીને અટકે છે. વૃક્ષ પાડીને પણ બચાવશે,
વૃક્ષ રણભૂમિને પણ બચાવશે, વૃક્ષ દરિયાકાંઠાની ભૂમિને પણ બચાવશે.
યોગ્ય ચયન કરવામાં આવે તો વૃક્ષો દરેક પ્રકારના નિવસનતંત્રને
બચાવશે. 'વૃક્ષ'ના અર્થને વિશાળ કરીએ તો તેમાં સમગ્ર પર્યાવરણનો
સમાવેશ થઈ શકે. વૃક્ષ સાથેનું ઐક્ય તમારામાં રહેલા પ્રકૃતિપ્રેમીને
કાર્યરત કરી દેશે. વૃક્ષ-ઉછેરથી વિશેષ પ્રકૃતિની સેવા બીજી કઈ હોઈ
શકે? પ્રકૃતિ-સંરક્ષણની કોઈ પણ વાત વૃક્ષોના જતન વિના અધૂરી
છે. પ્રકૃતિ-સંરક્ષણની જવાબદારી જેમના શિરે છે તેઓએ આ પાયાની
વાત ભૂલવી ન જોઈએ. વાતાનુંકુલિત કેલીનમાં, મબલખ વિદેશી
અનુદાનો વડે પર્યાવરણ સંરક્ષણ અંગે વિસ્તૃત અને જરીલ આયોજનો
ઘડતા અધિકારીએ હવે ખૂરપી લઈને બહાર નીકળવાની જરૂર છે!
અને આપણે સૌ પણ એ માટે તૈયાર છીએ?

૫૯

હંજ એટલે અનુકૂલનની ચરમસીમા!

ઉટની જેમ હંજ પણ ઉપરછલ્લી નજરે બેડોળ લાગે, સુંદર તો નહીં જ. પરંતુ, જે પ્રાકૃતિક પરિબળોએ તેઓની રચના કરી છે, તે પરિબળોથી રચાયેલા કઠોર પર્યાવરણમાં તેઓ અતિ સુંદર ફૂતિઓ બની જાય છે! મરુભૂમિ અને વિષમ ખારાપાટ પર મૃગજળની જેમ દ્રાષ્ટિગોચર થતાં આ બને પ્રાણીઓ, જીવસૂચિની સુંદરતા અને અદ્ભુત તકાતનો અહેસાસ આપે છે. બને, "અનુકૂલન" ની ચરમસીમા સુધી પહોંચા છે. ઉટને બાજુને મૂકી હંજ પર જ વિચાર કરીએ તો ઘ્યાલ આવશે કે, પક્ષીપ્રેમીઓ માટે હંજની બને જાતિઓ માટે ચિન્તા રાખવી કેટલી મહત્વની છે. કોઈ બાળકે હંસનું ચિત્ર દોર્યું હોય, અને તેમાં હંસના પગ અને ડોકને ખૂબ લાંબા દીર્ઘ હોય, સર્ફિદ શરીર પર ગુલાબી રંગ પૂર્ણો હોય, ચાંચ જારી અને છેવાડે વાંકી બનાવી હોય તો કેવું લાગે? પણ આ જ લાંબા પગ, ખૂબ લાંબી ડોક અને જારીવાંકી ચાંચે આ પક્ષીઓને જ્યાં બીજા કોઈ જીવ સહેલાઈથી જીવી ન શકે તેવા મદેશના અતિ સફળ રહેવાસી બનાવ્યા છે. કચ્છનાં મોટા અને નાના રણમાં જ્યારે પાણી ભરાય ત્યારે, હંજો માટે અતિ અનુકૂલ પર્યાવરણીય સંજોગો ઉત્ત્મ થાય છે અને તેઓ મોટી સાંચામાં પ્રજનન કરી શકે છે. ચોમાસાનાં વાદળો ભારતખંડ પર છવાય કે તરત જ આ વિસ્તાર તરફ હંજો પ્રયાણ કરે છે, અને જેવાં પાણી ફેલાય કે તરત જ પ્રજનનનું કાર્ય ચાલુ કરે છે. હંજની બને જાતિઓ માટે કચ્છનાં રક્ખો અતિ મહત્વનાં છે. આના કારણે આ વિસ્તારો પર માનવીનું અતિકમણ, હંજો માટે ઘણું ગંતીર નીવડે. વણવિચારી કાર્યવાહિથી બને જાતિઓને જોખમ રહે. અતિ "અનુકૂલન" નો આ ગેરવાભ! માનવજાતિને શિરે મોટી જવાબદારી!

જીવનસંઘર્ષમાં અતિ નાજુક તથા અલ્પરક્ષિત પરિસ્થિતિમાં હંજોનું ટકી રહેણું તો જ સમજાય જો આપણે તેઓની અનુકૂલન પ્રક્રિયા પર નજર કરીએ. હંજો એ બતક, ગાજહંસ, અને રાજહંસના નિકટના સંબંધી છે. તેઓની આતલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પૂર્વી પર ટકી રહેવાની

સફળતાનો, પાળતુ બતક અને ગાજહંસ સાથે સરખામણી કરીએ તો ઘ્યાલ આવે! આ બને પક્ષીજાતિઓ છીધિરા પાણી અને કાદવમાંથી ખોરાક કરી રીતે મેળવે છે તે સહેલાઈથી સમજાય છે. પાણી સાથે લીલ, જીવાત, અન્ય વનસ્પતિ, દાણા અને કાદવ ચાંચમાં લઈ ચાંચની બને બાજુથેથી પાણી બહાર કાઢે છે અને ખોરાક અંદર રહી જાય છે. ઘાનથી નિરીક્ષણ કરીએ તો ચાંચની બાજુથોમાં કાંસકીના દાંતા જેવા અવયવ દેખાશે, જેમાંથી પાણી બહાર ગળાઈને આવે છે. હંજની ચાંચ પણ આ રીતે પાણી અને કીચડમાંથી પૌષ્ટિક પદાર્થો અલગ પાડે છે, પરંતુ તેઓ પાણીની અંદરના અને કીચડ પરના શેવાળ પર વધારે નિર્ભર રહે છે. સાથે સાથે, કાદવમાંના કાર્બનિક (Organic) પદાર્થો પણ આરોગી છે. પાણીમાંની જીવાતો પણ મોટા પ્રમાણમાં અંદર લેવાય છે. લાંબા પગ અને લાંબી ડોકથી વધારે ઉડા પાણીમાંનો કાદવ આરોગી શકે છે. ઉડા પાણીમાં બતક જીવી ચાંચથી કાદવ ઉલેખયો મુશ્કેલ બને પરંતુ હંજની વાંકી ચાંચ ખૂબ સહેલાઈથી તે લઈ શકે છે. હંજ કાદવમાંથી ખોરાક મેળવવામાં અતિ વિચક્ષણ છે. ખોરાક લેતા હંજનું નિરીક્ષણ કરીએ તો દેખાશે કે, તેઓ પગથી કાદવ ખૂંદતા હોય છે. જે જ્યાયાઓમાં હંજોએ ખોરાક શોષ્યો હોય તેવી જ્યાયાઓએ કીચડમાં ગોળ ખાડા સર્જાય છે. કાદવ ખૂંદતાં ખૂંદતાં પક્ષીઓ ગોળ ફરતા દેખાશે. ઉલેખનીય વાત એ છે કે, બચ્ચાંની ચાંચ સીધી હોય છે અને વળાંક થીમે થીમે દેખાવા મારે છે. જ્યાં સુધી ચાંચનો વળાંક પૂરેપૂરો નથી થતો ત્યા સુધી બચ્ચું તેનાં માં બાપ પર ખોરાક માટે આધારિત રહે છે. આ ખોરાક એક ખાસ પ્રકારનું પ્રવાહી હોય છે જે પ્રજનન સમયે મોટાં પક્ષીઓનાં જઠરમાંથી પેદા થાય છે. શેવાળ અને કાદવ કીચડમાંથી પોપણ મેળવવા માટે હંજો અતિ અનુકૂલિત બન્યા છે તે વાત સમજાય, પરંતુ આના કારણે હંજ મુશ્કેલીમાં શા માટે સુકાય? કાદવ અને જલખાવિત વિસ્તારો બ્યાપક છે. બતક, ગાજહંસો, બગલા તથા કીચડિયાની અનેક જાતિઓ ખોરાક માટે આવા વિસ્તારો પર નિર્ભર હોવા છતાં ચિન્તા કેમ હંજ માટે જ હોવી જરૂરી? આ પ્રશ્ન સ્વાભાવિક છે અને તેનો

ઉત્તર દેવો ખાસ જરૂરી છે. પ્રથમ, લગભગ બધી જીતિઓ પર વધારે ઓછા પ્રમાણમાં મનુષ્યસર્જિત ઝોખમો તોળાઈ રહ્યા છે, જે વધતાં જાય છે. પરંતુ, અતિ અનુકૂળિત જીતિઓ વધારે ખતરામાં મૂકાય છે કારણકે, તેઓની જીવનવ્યવસ્થામાં કોઈ સમયે, કોઈ કાર્ય થતી વખતે જરા પણ અડયણ ઊભી થાય તો તે વધુ અનુકૂળ થવાની ક્ષમતા ધરાવતી નથી. હંજ માટે અતિ નિર્જાપુર્યક સમય તેના પ્રજનનકાળ દરમિયાન છે. ખોરાક માટે આખો ઉપયોગ છે અને પ્રજનન સમયે પણ હંજ વધારે ઓછી સંખ્યામાં ભલે ગમે ત્યાં દેખાય છે, પરંતુ પ્રજનન કરવા માટે આપણા વિસ્તારમાં કચ્છનાં બે રણ અને રાજ્યસ્થાનમાં સાંભર તળાવ, એમ જ્ઞાન જ યોગ્ય જગ્યાઓ છે. આ જગ્યાઓમાં યોગ્ય પર્યાવરક્ષિય સંજોગો વરસના અમુક ગણામાં ઊભા થાય છે અને એ પણ નિયમિતપણે નહીં, જો ચોમાસું નભજું હોય તો પ્રજનન માટે વિપરીત વાતાવરણ સર્જય. આમ

બે જ્ઞાન વરસ કોઈ પ્રજનન થાય નહીં એવું પણ બને! જો વરસાદ સારો થયો હોય તો અનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય અને બધાં હંજ પ્રણાયલીલા આદરી છે. પાછલો વરસાદ ઓછો પેટ તો પાછી જલદી સૂકાઈ જાય અને પક્ષીઓ હેડાં અને બચ્ચાં સાથેના માળાઓ ત્યજી છે. મોટા પાયે બચ્ચાં મરી જાય. છતાં સારા વરસોમાં પ્રજનન એટલું મોટા પાયે થાય કે, ખરાબ વરસોની ખોટ પૂરી થઈ શકે. આમ, હંજની વસતી સદીઓથી ટકી રહી છે. મૂળ પ્રશ્નનો જવાબ હજ મળ્યો નથી, તળાવો વધ્યાં છે, જળપ્લાવિત વિસ્તારો સારા પ્રમાણમાં વ્યાપક છે, તો રંગોમાં જ શા માટે મોટી માળા વસાહતો થાય છે? રણોના અવિશ્વસનીય વાતાવરણ ઉપર શા માટે નિર્ભર રહે છે? આ જ હંજોની ચરમસીમાં એ પહોંચેલા અનુકૂળનું રહસ્ય છે! (કમશઃ..)

૧૪, જયંત સોસાયટી, રાજકોટ ૩૬૪૦૦૪



નિર્વીક્ષાલા નોંધ



કલોલની સીમામાં પક્ષીનિર્દીક્ષણની નોંધ

આ વર્ષ (૨૦૦૪) વરસાદ સારો થયો હોવાથી કદાચ હંજ મારે ત્યાં (ગોપાલનગર) છેંક એપ્રિલની શરૂઆતમાં પદ્ધાર્યા, જે સામાન્ય રીતે ઓક્ટોબરના અંતમાં આવી જતા હોય છે.

છેલ્લાં અંકી વર્ષથી એક વેરાન વગણમાં મેં કુદરતી પશુ-પક્ષી આશ્રયસ્થાન શરૂ કર્યું છે અને મારા ખેતરમાં હ્યાત બાવળો અને વખડા, વખડીની જાડીને એનો એક ભાગ બનાવ્યાં છે. મારા 'એનીમલ કીપર' ડેક્કેડાશી પાણીનાં કુંડાં ભરે છે. હવે તો વેરાન વગડેય પાણી પીવા અનેક પક્ષીઓ આવવાં માંડ્યાં છે.

પાણીની ટાંકીની ઉપર જ એક શક્કરખોરા (Purple Sunbird) એ માળો બનાવ્યો છે અને 'એનીમલ કીપર' કે મારી એને કોઈ જ બીક લાગતી નથી. લેલાનું કર્ણપ્રિય (!) સંગીત લગભગ ચાલુ જ રહે છે અને પોપટ (Roseringed Parakeet) સાથે સાથે સવાર-સાંજ તૂટી

પણ ક્રારેક આવી જાય છે. ગયા વર્ષ જે 'નેસ્ટબોક્સ' માં ચીબરીએ 'નેસ્ટાંગ' કર્યું હતું, ત્યાં આ વર્ષ બ્રાલાઝી મેનાએ જવા આવવાનું ચાલુ કર્યું છે. લીમડા ઉપર જિંચે મુકેલા 'નેસ્ટબોક્સ' માં ચીબરીની કદાચ બીજી પેઢી ઊછારી રહી છે, જે રાને કોઈ પણ અજાણી વ્યક્તિ કે પશુને જુદે તો ધોંઘાટ કરી મૂકે છે. એક નેસ્ટ બોક્સની આસપાસ ઘણા દિવસો સુધી જોવા મળેલો સોનેરીપીઠ લક્કડાખોડ (Goldenbacked Woodpecker) હમણાંથી જોવા મળતો નથી. એક શક્કરખોરાએ વળી મારી ગાયના કોઠ ઉપર, બાવળમાં માળો બાંધ્યો છે.

જાના દિવસે હું મારી ઘારી ઘોડી 'સત્ત્રિ'ને લઈને વગણમાં ફરવા જાઉં દ્યું ત્યારે, કુદરતનાં અનેક રહસ્યો જ્યાં ખુલે છે. તા. ૧૦ એપ્રિલે જ્યારે હું 'સત્ત્રિ'ને લઈને ફરવા ગયો ત્યારે રસ્તામાં મને ટેવચકલીનો માળો જમીન ઉપર કરેલો જોવા મળ્યો. જમીન પર સુકાઈ જઈને પેલા કાંટાના એક સાથ નાના ઢગલા નીચેથી દેવચકલી ઊડાને ગઈ એટલે મેં ત્યાં જોયું તો જાંખરામાં જમીન ઉપર જ વાડકી જેવડો

સરસ માળો એણે બનાવેલો અને એમાં ચકલીનાં જેવા ચાર ઈડાં મુકેલા. મને એના માણાને 'ઓર્જર્વ' કરતો જોઈને, કે મારી ધોરી 'સત્ત્રિને' મારી આસપાસ ફરતી જોઈને એ એક ઊર્ચી જાડી પર બેઠી અને ભયસૂચક અવાજ કરવા લાગી. તાંથી આગળ ગયો એટલે એક નવપલ્લવિત મહુડાના થડમાં સુંદર રીતે કોરેલા કાણામાંથી પોપટો અવાજો કરતા જોવા મળ્યા. આવા સુંદર અને ઉંડા કંખાં તો પોપટો ન બનાવી શકે. શું એમણે લક્કડઘોડનાં કાણાં 'નેસ્ટીંગ' માટે ઉપયોગમાં લેવા માંડ્યા હશે??? અને... મહુડાને અરીને જ ખેતરના શેઢાનો જે ટેકરો હતો તેમાં વળી પતરંગા ચાંચથી ખોદ્યા હતા. એ જ ખેતરમાં સામે છે એક વિશાળ રાયણનું વૃક્ષ હતું. મને થયું કે, એક જ ખેતરમાં આ મહુડો અને રાયણને સાચવી રાખનાર ખેડૂતને પુરસ્કાર આપવો જોઈએ.

જાન્યુઆરીના છેલ્લા દિવસમાં પાટણ પાસે આવેલા રણુંજ ગામ પાસેથી પસાર થતી રૂપેણ નદીના કોતરોમાં મેં એક 'ટ્રેકિંગ એક્ઝિસ્પીડીશન'નું આયોજન કરેલું; એટલે હું અને મારો નાનો ભાઈ 'ટ્રેક રૂટ' એક કરવા માટે ગયા. સૂકા ભક્ત કોતરોમાં એક માત્ર ગાંડા બાવળો સિવાય કશું જ ન હતું. વહેળાના પટમાંથી આસપાસની ઊર્ચી ભેખડો ઉપર, ઉગેલા દેશી બાવળ, ખોજડા અને થોડા લીમદાનાં વૃક્ષો દેખાતાં હતાં. પણ અમને નવાઈ એ લાગી કે કોતરોમાં અને પટમાં ઉગેલા ગાંડા બાવળોમાં ય પક્ષીઓ આનંદથી કિલ્લોલ કરતાં હતાં. ગાંડા બાવળનાં ઝંડોમાં અમને અનેક તેતર જોવા મળ્યાં. આ સિવાય રણપિદા, રજા બુલબુલ, બુલબુલ, લલેકીઓ અને ગ્રાણેક ઊળખી ન શકાય તેવાં પક્ષીઓ જોવા મળ્યા. શક્ય બન્યું એટલાની અમે વિદીયો ફિલ્મ ઉતારી. કોતરોની ભેખડોમાં નાની નાની બખોલો હતી જ્યાં નાનપણમાં મેં અનેક પીરપલિયાં એટલે કે પતરંગા જોયેલા. ત્યાંનાં લીકો પતરંગાને 'પીરપલિયાં' અને રજા બુલબુલને 'દેવચુડા' કહે છે. કેટલાં સુંદર નામ! એરે... એક જગ્યાએ તો અમને ભેખડોની ઉંડી બખોલોમાં જતા-આવતા પોપટ (Roseringed Parakeet) જોવા મળ્યા. બાજુમાં થોડે દૂર સુગરીના માળા લટકતા હતા. મારા ભાઈએ એની વિદીયો ફિલ્મ ઉતારી.

અમે સવારે ૬-૩૦ વાગ્યે ચાલવાનું શરૂ કરેલું અને બપોરે લગભગ ૪ વાગ્યાની આસપાસ ૧૭ થી ૧૮ કિ.મી.નું અંતર કાપી વાણવલી પહોંચાં, પરંતુ જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય એવું એક પક્ષી મને ત્યાં જોવા મળેલું. તેની વિદીયો ફિલ્મ ન ઉતારી શક્યા, એનો રંજ આજે પણ છે. જે ભેખડોની બખોલમાં અમને પોપટ જતા આવતા જોવા મળેલા એ જ ભેખડોમાં થોડે આગળ એક બે ટેકાણો સંફેદ અધાર પડેલી જોઈ અમે ધુવડ વિશે વિચારતા હતા. ત્યાં જ અચાનક અમારી સાવ નજીકથી એક ધુવડ ઉડતા ઉડતાં અમારી સામે જોતા જોતા એક દૂરની ભેખડ પર જઈને બેઠો. એના વિશાળ સોનેરી ભભા અને ઉડતાં ઉડતાં અમારી સામે જોવાની રીત ક્યારેય નહીં ભુલાય. જીવનમાં પહેલી વાર મને ધુવડ જોવા મળેલો અને તે પણ એવી રીતે ઉડીને જતો રહ્યો, એટલે મને હું:ખ થયું. વિદીયો ફિલ્મ ઉતારી પણ એ જોઈએ એવી સ્પષ્ટ નથી, પરંતુ હું અને મારો નાનો ભાઈ બંને એમ માનીએ છીએ કે એ મોટો ધુવડ (Great Horned Owl) જ હતો. બીજુ એક ખાસિયત એની અમે એ નોંધી કે, આટલી વિશાળ પાંખો અમારી નજીકથી વિઝાઈ છતાં એનો-પાંખોનો કોઈ જ અવાજ નહોંતો સંભળાયો. (ધુવડની પાંખો સુંવાણા પીછાથી આચાદિત હોય છે તેથી પાંખો વિઝાતી વખતે અવાજ આવતો નથી. નિરવ ઉડાન તેના રાની શિકાર માટે આવશ્યક છે. - સં.) પંદર દિવસ પછી 'ગૃપ'ને લઈને જ્યારે ખરેખરું 'ટ્રેકિંગ' કર્યું તારે ત્યાં કંઈ જ જોવા ન મળ્યું.

સંદીપ બ્રલબાઈ 'પલાશ'

૨/૧૬ બી ગોપાલનગર, પંચવટી વિસ્તાર, કલોલ-૩૮૨૭૨૧

•૭૦૦૭૦૦•

ગોડલમાં પક્ષીનિરીક્ષણની નોંધ

તા. ૨-૬-૦૩ ના રોજ સાંજે ૫-૪૫ વાગ્યે હિતેખભાઈ દવે તથા અશોકભાઈ મશરૂ (રાજકોટ) સાથે મેં, ગોડલ નજીક આવેલી ઉમવાડા વીડીની બાજુમાં આવેલા એક ખેતરની પાસે બે અલગ અલગ જગ્યાઓએ બે નર ખડમોર (Lesser Florican) ને નૃત્ય કરતા જોયા હતા. આ બંને જગ્યાઓ હિતેખભાઈ દ્વારા દર્શાવવામાં આવી હતી.

નિરીક્ષણ નોંધ

આશરે ૨૦ મિનિટ સુધી થોડી થોડી વારે અવાજ કરવાની સાથે ફૂડક મારતા જોયા.

આ સિવાય ઉમવાડા વીડીમાં અમે જોયેલા પક્ષીઓમાં નીચેનાં મહત્વનાં અવલોકનો હતો.

દોરબગલો (Cattle Egret), કાળી કંકણસાર (Black Ibis), નાની કંકણસાર (Glossy Ibis), કપાસી (Blackwinged Kite), પદ્ધીપટાઈ (Montagu's Harrier), Grey Quail, તલિયો તેતર (Painted Partridge), ભોંયકલી (Blackbellied Finch Lark), મોટો ચંદૂલ (Syke's Crested Lark), મોટો લટોરો (Large Grey Shrike) પચનક લટોરો (Baybacked Shrike), બુલખુલ (Redvented Bulbul), થોરિયું લેણું (Common Babbler), ગંદમ (Striolated Bunting), ટ્યુસિયું (White throated Munia).

મેં અને હરિકૃષ્ણ નિવેદીએ ઉમવાડા વીડીમાં સાંજના સમયે એક સાથે ૫૦ થી ૬૫ જેટલી પદ્ધીપટાઈ (Montagu's Harrier) જોઈ હતી. તા. ૩-૧૧-૦૩ સમય ૫:૩૦ ઉપરાઉપરી ત્રણ થી ચાર દિવસ સુધી, દરેક વખતે જોવા મળી હતી.

અમે વેરી તળાવે સવારે ૮:૩૦ વાગ્યે તા. ૧૦-૮-૦૩ ના રોજ બે લાલ ટપુશિયા (Red Munia) જોયા હતા. થોડી વાર નિરીક્ષણ કર્યું, પછી ઉડી ગયા.

ગોડલ નજીક દૂધરાજ

મેં, હિતેખાઈ તથા અલખડિશોર રાવલે ગોડલ નજીક કોટાસાંગાડીમાં એક બગીચામાં એક નર દૂધરાજ (Paradise Flycatcher)ને વાંસની જાડીમાં બેઠેલો જોયો. તા. ૧૮-૦૨-૦૪, સમય ૧:૩૦. આ સિવાય હિતેખાઈના જણાવ્યા અનુસાર તેમજે બીલેશ્વર મંદિરે (ગોડલની બાજુમાં) એક દૂધરાજ જોયો હતો.

મેં અને અલખડિશોરે પણ એક દિવસે સવારે દૂધરાજ ને આશાપુરા ગાડીન (ગોડલ)માં જોયો છે. (તારીખ? -સં.)

મેં અને બોમકેશ રાવલે આશાપુરા ગાડીનમાં સાંજે લગભગ ૪:૪૫ વાગ્યે એક ઘૂંકિયા (Crow-Pheasant)

યુગલને પાંખરતા (mating) જોયું હતું. તા. ૨૫-૦૨-૦૪

તા. ૧૨-૧૨-૦૩ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યે, આશાપુરા તળાવના પુલની સમાંતર પસાર થતા એક તાર પર એક સાથે ૭ થી ૮ ચીબરી (Spotted Owllet) જોઈ, જે તાર પર બેસી 'કોલ' આપી રહી હતી. કોઈ અંયક્ષ્યાળું વ્યક્તિ તો ચોક્કસ આ દ્રશ્ય જોઈ ડરીને નાસી જાય. અમે તેમને ત્યાં લગભગ ૨૦ મિનિટ સુધી કલબલાટ કરતા સાંભળી હતી. તાર બાદ અલગ દિશામાં ઉડી ગઈ હતી.

તા. ૧૨-૦૧-૦૪ના રોજ વેરી તળાવ પાસે સાત સફેદ ઢોક (White Stork) જોયા હતા.

વેરી તળાવ પાસે પક્ષીનિરીક્ષણ

સ્થળ : વેરી તળાવ તા. ૧૨-૧-૦૪

૨૦ મોટી ચોટીલી દૂબકી (Great Crested Grebe), ૪૮૦ ગુલાબી પેણ (Rosy Pelican), ૧૨ ચોટીલી પેણ (Dalmatian Pelican), ૩૦ નરી બગલો (Purple Heron), ૧૩૦ પીળીચાંચ ઢોક (Painted Stork), ૨૦ ફાટીચાંચ ઢોક (Openbill Stork), ૮ સફેદ ઢોક (White Stork), ૧૨ સફેદ કંકણસાર (White Ibis), ૫૦ કાળી કંકણસાર (Black Ibis), ૧૦૦ ચમચા (Spoonbill), ૧ મોટો હંજ (Greater Flamingo), ૩૦ બ્રાંબણી બતક (Ruddy Shelduck), ૨૦૦ નકટા (Comb Duck), ૨૪૦ સિંગપર (Pintail), ૩૦૦ ટીલિયાળી બતક (Spotbill), ૮૫ લુહાર (Gadwall), ૭૦ જિરજા (Cotton Teal), ૪૫૦ પિયાસણ (Wigeon), ૪૦ કાબરી કારચિયા (Tufted Pochard), ૧૪૦ રાખોડી કારચિયા (Common Pochard), ૨૭૦ નાની મુરધાણી (Common Teal), ૧૩૦ ચેતવા (Garganey), ૬૦૦ ગયપો (Shoveller), ૩૦ કુંજ (Common Crane), ૬ કરકરા (Demoiselle Crane), ૧૦ કબૂત બગલો (Grey Heron), ૪૫૦ ભગતડાં (Coot), ૧૫ (Pheasant tailed Jacana), ૨૦ (Blackwinged Stilt), ૧૩૦ ટિટોડી (Redwattled Lapwing), ૩૦ વગડાઉ ટિટોડી (Yellow-wattled Lapwing), ૮૦ રાતાપગ (Redshank), ૨૦ મોટો લીલાપગ (Greenshank), ૮૦

તુતવારી (Common Sandpiper), ૨૨૦ કાળપણ ક્રીચડિયા (Little Stint), ૩૦૦ ટીલિયા (Ruff), ૧૫૦ શ્યામશીર ધોમડો (Blackheaded Gull), ૧૭૦ કાશ્મીરી વાબગલી (Whiskered Tern), ૩૫ મોટી વાબગલી (Caspian Tern), ૭૦ કેચીપુંછ વાબગલી (River Tern), ૨ મત્સ્યભોજ (Osprey), ૩૦ પાનપઢાઈ (Marsh Harrier). આ ઋતુમાં હુંજ, ૧૮૦ થી ૨૨૦ જેટલી નોંધાયેલી છે.

મત્સ્યભોજ જેવાં અમુક પક્ષીઓને બાદ કરતા આંકડાઓ લઘુત્તમ અંદાજ દ્વારા તારવવામાં આવ્યા હતા.

અચિકેશ જેખી

શ્રદ્ધા, સહજાનંદ નગર, રેલ્વે સ્ટેશન પાછળ, ગોંડલ-૩૬૦૩૧૧

૧૯૭૦-૧૯૭૧

જીમનગર જિલ્લામાં ‘પાઈડ મેના’

તા. ૨૮-૦૩-૦૪ના રોજ હું, જ્યપાલસિંહ જેઝ તથા બીજા બે મિન્ટો મેહુલ તથા સૂરજ, જીમનગરની બાજુમાં આવેલ વિભાપર ગામે પક્ષીનિરીક્ષણ અર્થે ગયેલા. ત્યાં અમારા આશ્રય વચ્ચે પાઈડ મેના (Pied Myna) જોવા મળી. ફક્ત એક જ પક્ષી ગંગાકાખર (Bank Myna) ના જૂથ સાથે ફરતું હતું, ચણતું હતું અને ‘કોલીંગ’ પક્ષી કરતું હતું. જીમનગર બાજુ કદાચ આ પક્ષી બહુ જોવા મળતું નથી. તો ફક્ત એક જ પક્ષી શું ગંગાકાખરના જૂથ સાથે આવી ગયું હશે? ગામની વચ્ચોવચ્ચ પટેલ સમાજની વાડી સામે આ પક્ષી જોવા મળેલ. (પોરબંદરના હુંડી વિસ્તારમાં આ પક્ષી જોયાની ભરત રૂધારીની નોંધ, વિહુંગ અંક ૮, શ્રીધ ૨૦૦૦, પાન ૧૧-૧૨-સ.)

ખીજડિયામાં ગાજહંસ

‘વિહુંગ’નો શિશિર-૨૦૦૪નો અંક મળ્યો. પ્રથમ જ લેખ ‘પંખીઓના વાપમાં થતા ફેરફાર’ વાંચી, આગળનું ‘વિહુંગ’ વાંચવાનું મુલતવી રાખી આ પત્ર લખી રહ્યો છું. ગાજહંસ તથા રાજહંસના વધતા જતા વાપના સંદર્ભમાં થોડો ઉમેરો કરવા સદ્ગુલાગી બનવાનો આ વર્ષ અનેરો મોક્કો મને પ્રમાણ થયો છે.

આ વર્ષ ૭૮૮ ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે હું અને

જ્યપાલસિંહ જેઝ ખીજડિયા પક્ષી અભ્યારાજ્યની મુલાકાતે ગયા. મુલાકાતનું મુખ્ય પ્રયોગન કાળીડોક દોંકની (Blacknecked Stork) એક જોડીએ આ વર્ષ સફળતાપૂર્વક પ્રજનન કર્યું તેની નોંધ લેવાનું હતું. કાળીડોક દોંકનો માળો એટલો વિશાળ હતો અને બાંધે બચ્યાં તથા એક પુષ્પ પક્ષી માળામાં લપાઈને એવી રીતે બેઠેલા કે માળો સંપૂર્ણ ખાલી લાગે. તેમને ખેલ ન પહોંચે એટલે દૂરથી અમે આ નિરીક્ષણ કર્યું, પરંતુ પક્ષી કે બચ્યાં જોવા ન મળ્યાં. તે દિવસે પક્ષીનિરીક્ષણ કરી અમો જીમનગર પરત ફર્યા. બીજા દિવસે એટલે કે ૮૮૮ ડિસેમ્બરએ હું એકલો જ ફરી ખીજડિયાની મુલાકાતે જવા નીકળી ગયો. ‘વાઈલ લાઈફ ફોટોગ્રાફી’ મારો શોખ હોવાથી આ દિવસે નકટાની ફોટોગ્રાફી કરવી તેવો ઉદ્દેશ હતો. ખીજડિયામાં હુંવાવ સાઈડનો પહેલો ગાળો અને તેની આસપાસ સામાન્ય રીતે નકટાનું એક મોઢું જૂથ જોવા મળતું. હું સવારે લગભગ ૭-૧૫ વાગ્યે ત્યાં પહોંચી એક બાવળની ઓથે શાંતિથી બેસી ગયો. ત્યાંથી નિરીક્ષણ કરતા થોડે દૂર જ્યાં મોઢું ધાસ ઉગેલું હતું, તેની આસપાસ ૮ જેટલા મોટા કદના પક્ષીઓ જોયા, એટલે માન્યું કે નકટાનું ‘શ્રુપ’ બેહું લાગે છે. સૂર્યના કિરણો હજ ત્યાં સુધી પહોંચતા નહોતા. સૂર્યપ્રકાશ નીકળતાની સાથે જ ત્યાં બેઠેલા ‘શ્રુપ’ને શાંતિથી જોવાનો મોક્કો મળ્યો. હું માન્યી ન શક્યો કે, હું જે પક્ષીઓને જોઈ રહ્યો છું તે કોઈ નહીં, પરંતુ ગાજહંસ(Greylag Goose) છે!

મારી ખુશીનો પાર ન હતો. થોડો સૂર્યપ્રકાશ નીકળતા મને આ વિરલ પક્ષીની ફોટોગ્રાફીની પણ ઉમદા તક મળી. વહેલી સવારથી હું ત્યાં બેઠો હતો તેથી તેમને મારી હાજરી ખટકી નહીં અને થોડા ‘ફોટોગ્રાફ’ હું લઈ રહ્યો. ખીજડિયા પક્ષી અભ્યારાજ્યમાં આ પ્રથમ વખત ગાજહંસ રેકોર્ડ થયા હતા. જીમનગર, ‘મરીન નેશનલ પાર્ક’ના શ્રી જાની, ‘કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ’, શ્રી અસારીને ફોટોગ્રાફ સાથે પત્ર આપી ખીજડિયાની યાદીમાં ગાજહંસનો ઉમેરો કરવાની લેખિત જાગ્રત્ત કરી.

અત્યારે આ સંખ્યા લગભગ ૨૨ જેટલી થઈ છે. મે ૮૮૮ ડિસેમ્બર પ્રથમ વખત જોઈ ફોટોગ્રાફ લીધો ત્યારે ૮૮૮ સંખ્યા હતી.

ભુજ તથા આસપાસ પક્ષીનિરીક્ષણાની નોંધ

તા. ૩૦-૦૫-૦૪ના રોજ છારી ઢંગની મુલાકાત દરમિયાન નીચે મુજબનાં પક્ષીઓ જોવા મળ્યાં. સાથે એ.સી.એફ. શ્રી.જે.એસ.સોલંકી અને આર.એફ.ઓ. નલિયા, શ્રી.આર.ડી. જાડેજા હતા. આ દિવસે પક્ષીગણતરી રાખવામાં આવેલી. ચાર ટુકડીઓ પાહવામાં આવી હતી. તેમાં અમારી ટુકડીને જોવા મળેલ પક્ષીઓની નોંધ મોકલું છું.

૨ સફેદ ઠોક (White Stork), ૩ કાળીડોક ઠોક (Blacknecked Stork) બે પુખું એક અપરિપક્વ, ૧ દેશી ગરુડ (Tawny Eagle), ૧ મત્સ્યભોજ (Osprey), ૩ મોટા તેજપર (Collared Pratincoles), ૨૮ ઉલટીચાંચ (Avocet), ૧૮ મોટાં હંજ (Greater Flamingo), ૩૩ નાનાં હંજ (Lesser Flamingo), ૬૮ પીળીચાંચ ઠોક (Painted Stork), ૨૦૩ મોટી વાખગલી (Caspian Tern), ૪ વાખોમીઠી Slenderbill Gull), ૧૮ દરિયાઈ બગલા (Reef Heron), ૬૮ ભગતડા (Coots), ૨૮ ઘોળી કંકણસાર (White Ibis), ૭ કબૂત્ર બગલા (Grey Heron), ૨૬ ટીલિયાળી બતક (Spotbill Duck), ૩૫ કાળીપુંછ ગડેરા (Blacktailed Godwits), ૧૦ મોટા કાજિયા (Greater Cormorant), ૮૪૦ ચમચા (Spoonbill)

જીમનગરમાં પક્ષીનિરીક્ષણ

તા. ૧-૬-૦૪ અને ૨-૬-૦૪ના રોજ સાંજે, આયુર્વેદિક યુનિવર્સિટીના 'ગ્રાઉન્ડ'માં શકરા (Shikra) ને જોયો. બસે દિવસ એક જ વૃક્ષ પર બેઠેલ હતો. થોડી થોડી વારે શિકારનો પ્રયત્ન કરી પાછો આવતો હતો. તા. ૩-૬-૦૪ના રોજ લાખોટા તળાવ પર શ્રી જ્યપાલસિંહ જાડેજા સાથે પક્ષીનિરીક્ષણ કર્ય. નીચે પ્રમાણે પક્ષીઓ જોયા.

૧ ફાટીચાંચ ઠોક (Openbill Stork), ૪૨ ટીલિયાળી બતક (Spotbill Duck), ૧૬૦ નાના કાજિયા (Little Cormorant), ૧૮ મોટા કાજિયા (Large Cormorant), ૧૧ મોટાં હંજ (Greater Flamingo), ૮

કબૂત્રબગલા (Grey Heron), ૮ મોટા બગલા (Large Egret), ૮ ગજપાઉ (Blackwinged Stilt), ૧૨ કશ્મીરી વાખગલી (Whiskered Tern) પ્રજનન પોશાકમાં.

એક ટીલિયાળી બતક દે બચ્ચાં સાથે જોવા મળી.

શયામશિર કલકલિયો (Blackcapped Kingfisher) જીમનગર જિલ્લામાં

'ફ્લેમિંગો'માં શયામશિર કલકલિયાની નોંધ મોકલવાનું જણાવેલું હતું. બીજાંદીયા પક્ષી અભ્યારણ્ય આશીષ કુણાલ અને બીહુએ તા. ૧૯-૧૨-૦૩ સવારે ૮:૩૦, એક પક્ષી. આશીષ-બીહુએ તા. ૨૮-૧૨-૦૩ સવારે ૭:૩૦, એક પક્ષી.

કમલ આર. ભક્ત
દ્યારામ લાયબ્રેરી સાથે, રજીઝાત રોડ, જીમનગર


ઋતુમાં પ્રથમ વાર નોંધાયેલાં યાયાવર પક્ષીઓ

તા. ૨૫-૦૭-૦૪, વૈયા (Rosy Pastor) (૦૭), સુરખાણ તેમ (તા. અંજાર)

તા. ૨૫-૦૭-૨૦૦૪, શેતપીઠ કીચડિયો (Curlew Sandpiper) (૧૨), છસરા તેમ (તા. મુદ્રા), ઉનાળુ પોશાકમાં.

તા. ૬-૬-૨૦૦૪ના રોજ દેવીસર તળાવ (તા. ભુજ) પર નીચેનાં વિશેષ પક્ષીઓ જોયા. આ પક્ષીનિરીક્ષણમાં મારી સાથે મારો પુત્ર મૌલિક જોડાયેલ.

૨ સર્પશ્રીવ (Darter), ૧૫ નડી બગલો (Purple Heron), ૨૦ નાની કંકણસાર (Glossy Ibis), ૨૫ નીલ જલમુરધો (Purple Moorhen), ૨ શેતપંખ જલમાંજર (Pheasant-tailed Jacana), ૨૦ મોટો હંજ (Greater Flamingo), ૪૦ ગજપાઉ (Blackwinged Stilt), ૩૦ નાની સિસોટી બતક (Lesser Whistling Teal), ૧ પાનવા (Painted Snipe).

આ ઋતુમાં જોયેલ ચાતક (Pied Crested Cuckoo) ની નોંધ

લેર તેમ (તા.ભુજ), ૧૨-૦૬-૨૦૦૪ (જોડી)
(ઝતુનો પ્રથમ); ખાડા (તા.માંડવી), ૨૭-૦૬-
૨૦૦૪(૦૧); પાલાર ધૂના (તા.નખત્રાણા) ૧૧-૦૭-
૨૦૦૪ (૦૧).

આ વર્ષમાં જોયેલ સુગરી

(Baya Weaver)નું પ્રજનન

તા. ૨૭-૦૬-૨૦૦૪ ખાડાની નદી (તા.માંડવી)
૨૦ માણા ૭-૮ નર પક્ષી
તા. ૧૧-૦૭-૨૦૦૪ પાલાર ધૂના (તા. નખત્રાણા)
૪-૫ માણા, પુખું પક્ષીઓ.

શેતપંખ કાળી વાબગલી

(Whitewinged Black Tern)ની

કચ્છમાં પ્રથમ નોંધ

તા. ૬-૬-૨૦૦૪ના રોજ દેવીસર તળાવ (તા.
ભુજ) પર પક્ષીનિરીક્ષણ કરતા ઉ કાશીરી વા બગલી
સાથે રે નવી જાતની વાબગલી જોઈ જે મોઢા નીચેથી
સંપૂર્ણ કાળી હતી આ અંગે પુસ્તક જોતા તે શેતપંખ કાળી
વાબગલી તરીકે ઓળખાઈ. કચ્છમાં તેની આ સૌ પ્રથમ
નોંધ છે. આ પક્ષીનિરીક્ષણ વખતે મારો પુત્ર મૌલિક પણ
મારી સાથે હતો.

ગુજરાતમાં તે જીમનગરના લાખોટા તળાવમાં ડો.
તેજ મુંદુકે ૧૪-૫-૧૯૮૮પના રોજ જોયેલ. વળી, સ્વ.
શિવરાજકુમાર ખાચરે આ પક્ષીની જસદણ નજીક, જૂન
૧૯૮૮ તથા એ ૧૯૮૫માં નોંધ કરેલ. આમ ગુજરાતની
નોંધમાં ત્રીજો ઉમેરો ગણી શકાય.

ઢોર બગલા (Cattle Egret)નું પ્રજનન

તા. ૨૮-૦૭-૦૪ના રોજ ભુજના હમીરસર તળાવ
નજીકના રાજેન્દ્ર બાગના વૃક્ષ પર ઢોર બગલા ના ઊ ૩૦
માણા જોયા. લગભગ દરેક માણામાં ૧ બચ્ચું હતું. આમ
૩૦ બચ્ચાં નજરે પડેલ. પુખું પક્ષીઓ બચ્ચાં માટે ખોરાક
લેવા ગયા હોય તેમ લાગ્યું.

શાંતિલાખ વડુ

જૂનાવાસ, મંદિરવાળો ખાંચો, માધાપર, ભુજ ૩૭૦૦૨૦

•••••

ગીરમાં પક્ષીનિરીક્ષણ

ગયા માસમાં નવરંગ (Indian Pitta) જેવા ગીરમાં
જવાનું થયું. અસંખ્ય પીહાના અવાજથી વનશી ગુજરતી
હતી. મે માસમાં આ પરદેશી મહેમાન વધુ બોલકણા બની
જાય છે તે અનુભવ્યું. કરમદી બીટના બીટગાડ શ્રી
ડાંગરભાઈ પક્ષીનિરીક્ષણનો શોખ ધરાવતા હોઈ આશરે
દસ ક્રિ.મી.ના ટ્રેકિંગમાં અવનવા પક્ષીઓ નિહાળ્યા. પક્ષી
સમૃદ્ધ ધરાવતું ગીરનું જંગલ ખરેખર વિવિધ પ્રાકૃતિક
સંપદા સાચવીને બેહું છે, તેની પ્રતીતિ થઈ. નોંધપાત્ર
અવલોકનોમાં નીચેનાનો સમાવેશ થાય છે.

૩ દૂધરાજ (Paradise Flycatcher), ૪ નવરંગ
(Indian Pitta), ૨ શ્યામશિર (Blackheaded
Cuckoo-Shrike), ૧ દશરથિયું (Nightjar), ૩ મધ્યિયા
(Honey Buzzard), ૧ ટીસો (White-eye Buzzard),
૨૦ શેતનયના (White-eye), ૩ રાખોડી રામચક્કી (Grey
Tit), ૨૫ તુર્ધ (Blossomheaded Parakeet) વગેરે.

પ્રવિષ્ટ ગોહિલ

મુ.વિકટર, તા. રાજુલા, જિ. અમરેલી ઉદ્પયપ્યે

•••••

કેચીપૂંછ વાબગલી (River Tern) ની

માળાવસાહિત

તા. ૪-૧૦-૦૩ના રોજ ન્યારી-૧ બંધની મુલાકાતે
છલતી નજીકના બેટા પર ૩૦-૪૦ કેચીપૂંછ વાબગલી
ઉડતી હતી. આ તેની પ્રજનન વર્તણૂક જણાઈ. તા. ૧૬-
૧૦-૦૩ના રોજ વાબગલીની પ્રવૃત્તિ ચાલુ હતી. માટીના
પાળના ઢાળ ઉપર ૧૦-૧૫ લહેરિયા ગંદમ (Striolated
Bunting) બેઠેલાં જોયા. તા. ૧૬-૧૦-૦૩ના રોજ
વાબગલીઓ ઈંડા સેવતી હતી. સંચા થતાં નાના કાજિયા
(Little Cormorant)ની હારો, જળાશયના કોઈ ગાંડા
બાવળના ઝૂંડ તરફ એક પછી એક રાતવાસ માટે જતી
હતી. આશરે ૧૦૦૦ નાના કાજિયા આવ્યા.

ડિસેમ્બરની એક મુલાકાતે જળાશયની સપાટી ઘટતાં
નવા બેટા ઉભરી આવ્યા હતા. તેની ઉપર સંખ્યાંબંધ
વાબગલીઓ કલબલાટ કરતી સતત ઉડતી હતી. ઘડી બધી

બેટા પર, ઈડાં પર બેઠી હતી. આશરે સંખ્યા ૧૨૦૦ હોવી જોઈએ. તા. ૧૦-૦૧-૦૪ ની પક્ષીગણતરી વખતે નિરીક્ષણ કરતાં કુલ તે બેટા પર માળાવસાહત થયાપણે હતી. તેમાંથી એક બેટ ઘણો મોટો હતો. વાબગલીઓની સંખ્યા વધી ને આશરે ૧૮૦૦-૨૦૦૦ થઈ હતી. બેટા પર બચ્ચાં પણ બેઠેલાં છાલતાં ચાલતાં જોયા.

તા. ૨૨-૦૨-૦૪ની મુલાકાતે વાબગલીઓની સંખ્યા ઘટીને ૧૦૦૦ આસપાસ થઈ હતી. બચ્ચાં, પુઅ પક્ષીઓ સાથે ઊડતાં પણ હતાં. હજુ વાબગલી બેટા પર ઈડાં સેવતી બેઠી હતી. કિનારા પર એક ફૂલનું આવી ચડતા ૨૦૦ વાબગલીનું એક ઝૂંડ અવાજ કરતું તેની પર ઊડતું, પછીન જઈ ભગડતું હતું. એવું અનુમાન થઈ શકે કે, જેમ પાછીની સપાઠી ઘટતી તેમ માળા વસાહત વધતી જતી હતી, અને પ્રજનન કમશઃ થયા કરતું હતું. પ્રજનન કદાચ બે ત્રણ વાર પણ થતું હોઈ શકે. આ પરથી માળાની સંખ્યાનું અનુમાન કરીએ તો તે ઓછામાં ઓછી ૬૦૦-૭૦૦ હોઈ શકે.

ન્યારી-૧ બંધ

તા. ૧૬-૧૦-૦૩ના રોજ બંધની છલતી પાસેથી દૂરભીનથી જળાશયને છેવાડે નજર ફેરવતાં પાણી વર્ગે આવી ગયેલા ગંડા બાવળના ઝૂંડ (Spoonbill) તથા કાજિયા (Cormorant) બેઠેલા નજરે ચંચાં. થોડા ચમચા ઊરીને તે તરફ જતા હતા. સાથે આવેલ શ્રી ઈન્દ્રભાઈ ગઢવીને કહું, “ચમચા માળા બનાવતા હોવા જોઈએ.” તેમણે પણ એ વાતને પુષ્ટિ આપ્યી. તા. ૧૬-૧૧-૦૩ના રોજ તે બાજુ જઈ ટેલિસ્કૉપિયથી ચકાસતા, બાર ચમચા માળામાં બેઠેલા હતા. એહેતું પણ કહું કે, સરેદ બગલા ધાસ-ડાળખાં લઈ જતાં તેણે જોયેલ. લગભગ ૧૫ વર્ષ પહેલા, તો. તેજમુંદુકુર સાથે હોડીમાં જઈ, આવી જ માળાવસાહતમાં ચમચાનાં બચ્ચાનાં રીંગ પહેરાવેલ, તે યાદગાર પળોનું સ્મરણ થઈ આવ્યું. ૧ માળો કબૂત બગલા (Grey Heron)નો, ૧ બચ્ચા સાથે જોયો.

પક્ષીગણતરી વખતે તા. ૧૦-૧-૦૪એ ફરી આ માળાવસાહતની મુલાકાત લીધી. હવે બાવળ સુકાઈ જતાં, આછા થઈ ગયેલ, તેથી ટેલિસ્કૉપમાંથી ચરકથી સરેદ

થયેલા નાનાં કાજિયા (Little Cormorant)ના માળા પણ સ્પષ્ટ દેખાઈ આવ્યા. નાના કાજિયાના ૧૧૦ તથા ચમચાના ૧૬ માળા હતા. કબૂતબગલો મોટા થયેલ બચ્ચાને ખવડાવતો નજરે ચઢ્યો. ટેલિસ્કૉપ ફેરવતા, આ વસાહતથી અલગ એવા બાવળના એક ઝૂંડ પર નહીં બગલો (Purple Heron) વારંવાર ઊંચો થતો પકડાઈ ગયો. વધુ નજીક જઈ બારીકાઈથી નિરીક્ષણ કરતા તે બેઠો હતો તેની બાજુમાં ગોપિત ર બચ્ચાં દેખાયા. તે આકાશ તરફ ચાંચ રાખી ડેકને મેચતો હતો. તેનું રહસ્ય સમજાતા મજા પડી. તેના માળા પરથી કેચી પૂછું વાબગલીઓ વારંવાર પસાર થતી હતી. તેથી આ તેની હદસંરક્ષણ (territorial behaviour) ની વર્તિંશું હતી. કબૂત બગલો(Grey Heron) અને નડી બગલા (Purple Heron) ના માળાની નોંધ, રાજકોટ માટે પ્રથમ વાર હોઈ શકે.

અશોક મશરૂ

અ/જ, આલાપ હેરિટેજ, સત્યસાઈ ડોસ્પીટલ પાસે, કાલાવાડ રોડ,
રાજકોટ ૩૬૦૦૦૧

• • •

કચ્છના નાના રણમાં પક્ષીનિરીક્ષણ

- તા. ૨૬-૧-૦૩ના રોજ હું, ચિહ્ન વોરા, કાર્ક ચૌકાણ, વિશાલ થોરિયા તથા પ્રશંસાત ચાવડા રણમાં બજાણાથી ટૂંકી બેટ સુધી ગયા હતા, જ્યાં અમે ૨ પરદેશી ગરૂડ(Steppe Eagle) તથા ટૂંકી જળાશય પર ૬૮ ટપકીલી ચાંચ પેશ (Spotbilled Pelican), ૩ ચોટીલી પેશ (Dalmatian Pelican), ગુલાબી પેશ(Rosy Pelican), કુજ (Common Crane), તથા વિવિધ બતકો અને નાનાં હંજ (Lesser Flamingo) જોયા.
- આ સાથે આપને હુડખર ગણતરી દરમિયાન અમે જોયેલા મહત્વનાં પક્ષીઓની યાદી મોકલાવીએ છીએ.

હુડખર ગણતરીમાં અમને અલગ કામ સોંપવામાં આવ્યું હતું. અમે ટિલોર (Houbara Bustard) ની ગણતરી કરનારા જીથમાં હતા.

અમે ૪ ટિલોર જીલંધર બેટમાં જોયા (તા. ૩૧-૧-૦૪). બીજા હિવસે, ૧-૨-૦૪ના રોજ અમે ૪ ટિલોર, કાલાવાડ બેટની કસીમાં જોયા હતા.

નિર્જીવણ નોંધ

સાબજા તળાવમાં અમે વિવિધ બતકો, કુંજ, કરકરા, ચમચા, ટોક, કંકણસાર, વિવિધ કાદવ ખૂંડનારા પક્ષીઓ (waders) વગેરે સારી એવી સંઘામાં જોયા.

ઉપરાંત અમે ત્રણ સારસ, એક હૂપુ લાર્ક (Hoopoe Lark) તથા ૧ તુરુભી (Redheaded Merlin) જોયા હતા.

યોગેન્દ્ર શાહ, ચિકુ વોરા, ફારુક ચૌહાણ
સુરેન્દ્રનગર

શક્કરખોરા (Purple Sunbird)નો માણો

શક્કરખોરાનો માળો મારા ધરના કોટનના છોડમાં બનાવેલો છે. આ માળો બનાવતા માદાને ૮ દિવસ લાગ્યા. માળો બનાવવાની શરૂઆત ૧૮-૩-૦૪થી કરી અને ૨૮-૩-૦૪ સાંજે પૂરો થઈ ગયેલ હતો. પછી ઉદ્ઘાસ માળો ખાલી રહ્યો. માળામાં માદાએ આવી અને ઈડાં મૂક્યા. અત્યારે માદા ઈડાં સેવી રહી છે.

નાયકા તેમ પાસે પક્ષીનિરીક્ષણ

તા. ૧૮-૧૨-૦૩ના રોજ હું, મશાંત ચાવડા, ચીકુ વોરા તથા વિશાલ થોરિયા નાયકા તેમ ગયા હતા. નાયકા તેમાં પાણીની પરિસ્થિતિ સારી હતી, તેથી પક્ષીઓની સંઘા સારા પ્રમાણમાં હતી. જોયેલાં પક્ષીઓમાં નોંધપાત્ર નીચે મુજબ હતા.

લીલટીચાંચ (Avocet) ૩, બગતડા (Coot) ૩૦૦+, કુંજ (Common Crane) ૨૮, કરકરા (Demoiselle Crane) ૩૦૦+, સારસ (Sarus Crane) ૪, બ્રાહ્મણ બતક (Brahminy Duck) ૫૦+, નકટા (Comb Duck) ૪૦+, ટીલિયાળી (Spotbill Duck) ૨૮૦+, કાળીપુંછ ગડેરા (Blacktailed Godwit) ૪૦+, નાના હુંજ (Lesser Flamingo) ૨૮, મોટાં હુંજ (Greater Flamingo) ૨૦, ગાજહંસ (Greylag Goose) ૭૦+, રાજહંસ (Barheaded Goose) ૨૨૦+, નાની કંકણસાર (Glossy Ibis) ૧૩, શેતપુંછ ટિટોડી (Whitetailed Lapwing) ૧, મત્સ્યખોર (Osprey) ૧,

શેતખાંખ કારચિયા (White-eyed Pochard) ૩૦+, રાખોડી કારચિયા (Common Pochard) ૩૦+, ગયણા (Shoveller) ૩૦૦+, સર્પશ્રીવ (Darter) ૨, નાની મુરધાબી (Common Teal) ૧૧૩.

ભાસ્કરપરા જળાશય ખાતે પક્ષીનિરીક્ષણ

તા. ૮-૧૧-૦૩ના રોજ હું, ચિકુ વોરા, ફારુક ચૌહાણ, મશાંત ચાવડા તથા વિશાલ થોરિયા, ભાસ્કરપરા પક્ષીનિરીક્ષણ માટે ગયા હતા.

ભાસ્કરપરા એ વિરમગામ અને લખતર વચ્ચે, અને વિહૃલગઢથી ડિ.મી. દૂર આવેલી નર્મદા કેનાલનો, 'વેસ્ટ વોટર એરિયા' છે. આ વખતે નણસરોવરમાં પાણીની સપાટી જ્યારે વધારે ઊંચી (લગભગ ૬') હતી ત્યારે અહિયા પાણીનાં યાયાવાર પક્ષીઓ માટે ખૂબ જ અનુકૂળતા હતી. અમે ખૂબ જ મોટી સંઘામાં પક્ષીઓ જોયા. મહત્વનાં નીચે મુજબ છે.

સિંગપર (Pintail) ૩૦૦૦+, ટિલિયાળી બતક (Spotbill Duck) ૨૦૦૦+, નાની મુરધાબી (Common Teal) ૬૦૦૦+, મોટાં હુંજ (Greater Flamingo) ૧૦૦+, નાનાં હુંજ (Lesser Flamingo) ૩૦૦+, બગતડા (Coot) ૧૫૦૦, ગયણા (Shoveller) ૨૦૦+, નીલશિર (Mallard), શુલાબી પેણ (Rosy Pelican) ૩૨, પીળીચાંચ ટોક (Painted Stork) ૬૨, નાની સિસોટી બતક (Lesser Whistling Teal) ૬૭, ઉલટીચાંચ (Avocet) ૩, સારસ (Sarus Crane) ૪, બ્રાહ્મણ બતક (Brahminy Duck) ૧૦૮, શેતપુંછ ટિટોડી (White-tailed Lapwing) ૨, ચમચા (Spoonbill) ૬૦+, કાળીપુંછ ગડેરા (Blacktailed Godwit) ૨૩૦+, પાનપક્ષી (Marsh Harrier) ૩, રાખોડી કારચિયા (Common Pochard) +૩૬.

યોગેન્દ્ર શાહ

આનંદ, અજિતનાથ સોસાયટી પાસે, જાતાન રોડ, સુરેન્દ્રનગર
૩૬ ૩૦૦૨

અમરેલી જિલ્લામાં પક્ષીનિરીક્ષણ

તા. ૨૩-૦૩-૦૪ના રોજ બાબરા ખાતે કામ સબબ

જવાનું થયેલ ત્યારે ત્યાંથી નજીકમાં આવેલ તળાવનું નિરીક્ષણ કરેલ, જેમાં બ્રાહ્મણી બતક (Brahminy Duck)-૨૦, ટીલિયાળી બતક (Spotbilled Duck)-૨૫-૩૦, ગયણા (Shoveller)-૪, ૨૫૦ ટોડી કારચિયા (Common Pochard)-૬ જોયેલ. આગળ, ૪ ટી.મી. દૂર કરીયાણાનું મોઢું તળાવ આવેલ છે, જેમાંથી પીયત માટે પાણી અપાતા મોટા ભાગનું પાણી ખાલી થયેલ છે. ખાલી વિસ્તારમાં વાવણી થવાથી ઊભો મોલ જોવા મળ્યો. જતાં વેત આટલા છીછરા પાણીમાં ગુલાબી પેણ (Rosy Pelican)નું ૧૫ થી ૨૦ નું 'શુષ્પ' જોવા મળતા આશર્ય થયેલ. તળાવમાં ૧૦-૧૫ (Painted Stork) હતા અને સુધ્યસ્તનો સમય થતાં બીજા પક્ષીઓનાં ૩ થી ૪ મોટાં જૂથ તળાવમાં આવતા હતાં, જે અંધારું થતા ન ઓળખાયા. ભગતડા (Coot) પણ મોટી સંખ્યામાં, અંદાજત ૧૫૦ જેટલા હતાં. ગત વર્ષ આ તળાવમાં અમરેલી જિલ્લામાં સૈચિંક સંસ્થાઓની સંકલન સમિતિએ પોંઝેલ પક્ષીગણતરી દરમિયાન બસે પ્રકારની (Rosy & Dalmatian) પેણ મળીને ૩૫૦-૪૦૦ જેટલી નોંધાયેલ.

ગજેન્દ્રભાઈ ભક

એક/૨૭, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમરેલી ઉદ્પદ્ધતિ

•••••

કાળી કંકણસાર (Black Ibis)ના માળા

તા. ૩-૪-૦૪ના રોજ મારા સુપુત્ર અર્જુનને ગોડલ, ચોટિલા, ડાંગરા (પડધરી નજીક) દર્શન કરાવવા જવા ખાસ વાહનમાં નીકળેલ, ત્યારે સવારે ૮-૦૦ વાગે વીગોરાણ ગામે પાનખર ઝુતુમાં પર્ણવિહિન થયેલા પીપરના વૃષ્ટિ કુંપળો ફૂટી જોયેલ. તેના ઉપરના ભાગે કાળી કંકણસારની જોડી જોયેલ. વહેલી સવારે માળો બનાવવામાં તલ્લિન હતા. થોડી વાર થતા બે પૈકી એક, માળો બાંધવા માટે તણખલું ચાંચમાં લાવી માળા પર આવેલ. માળાની શરૂઆત હોય તેવું લાગતું હતું.

ડાંગરા, પડધરી નજીક આવેલ નાનું ગામ છે. નાની સિંચાઈ યોજનાનો તેમ છે, પરંતુ પાણી સુકાવા આવેલ. થોડા પાણીમાં ટીલિયાળી બતક (Spotbilled Duck), ૧૫-૨૦ તથા પીળીચાંચ ઢોંક (Painted Stork), ૧૦-

૧૫ (પાંચેક ઉડતાં) જોયેલ.

ડાંગરથી પડધરી આવેલ. ત્યાં મુખ્ય માર્ગ પર ગામ વચોવચ, જેવી રીતે ઈગોરાળામાં પાનખર બાદનાં પીપરનાં વૃષ્ટિ ઉપર જોયેલ તેવી જ રીતે કાળી કંકણસાર સાંજના સમયે માળો બાંધતા જોઈ. માળો બાંધવાની શરૂઆત હોય તેવું જણાતું હતું. પડધરીથી નીકળતાં સરપદડ ગામના પાદરમાં નઈના પટ વચ્ચે ૫-૭ પીળીચાંચ ઢોંક જોયેલ જેમાં બે બચ્ચાં પણ હતાં.

તા. ૩૧-૦૪-૦૪ના રોજ ખાંભાથી જુનાગઢ એક લગ્ન પ્રસંગે જતો હતો હતો ત્યારે ધારી અને વિસાવદર વચ્ચે લાલપર નજીક, પ્રાક્ષ નદીના ડિનારે વડ ઉપર, કાળી કંકણસારની એક જોડી માળા ઉપર જોયેલ. તેવી જ રીતે વિસાવદર બસ સ્ટેન્ડમાં (કિં જગ્યાએ? - સં.) કાળી કંકણસારની જોડી માળા ઉપર જોયેલ. ગત સાલ પણ વિસાવદર બસસ્ટેન્ડમાં આ જ જગ્યાએ કાળી કંકણસાર આ જ સમયે માળા ઉપર જોયેલ.

મહુવા, વિકટર, ચાંચના દરિયાડિનારે પક્ષીનિરીક્ષણ

તા. ૨૮-૦૩-૦૪નાં રોજ મહુવા નજીક પીગેશરનાં ડિનારે 'કોસ્ટલ પેટ્રોલીંગ' કરેલ અને પક્ષીનિરીક્ષણ કરેલ. આ દરમિયાન મહુવાના જ્યાટેવભાઈ પાખલ પણ મળેલ. અમે બધાએ સાથે મળીને પક્ષીઓ નોંધિલ છે, જે નીચે મુજબ છે.

તા. ૨૮-૦૩-૦૪ના રોજ મહુવા નજીક પીગેશર દરિયાડિનારે ૫-૭ ટી.મી. ફરી પક્ષીનિરીક્ષણ કર્યું જેમાંનાં કેટલાક નીચે મુજબ છે.

નાના હંજ (Lesser Flamingo)-૧૬૭ (તેમાં બચ્ચાં પણ હતાં), પીળીચાંચ ઢોંક (Painted Stork) ૧૧, નાની ખલિલી (Whimbrel) ૪-૫, ખલિલી (Curlew) ૫, મત્સ્યભોજ (Osprey)-૪, ભૂલામણી ઢોંગીલી (Kentish Plover)-૧, ચેમચા (Spoonbill)-૨, દરિયાઈ બગલા (Reef Heron) ૨, સફેદ વાબગલી (Gullbilled Tern)-૮-૧૦, મોટી વાબગલી (Caspian Tern)-૫, શામશિર ઘોમડા (Blackheaded Gull) ૫, રૂપેરી બાટજા (Grey Plover)-૧૦, અખલાખ (Oystercatcher)-૨

નિરીક્ષણ નોંધ

આગળ જતા ચાંચ સોલ્ટપાનમાં :

રાતાપગ (Redshank) ૨૦-૨૫, નાનાં હજ (Lesser Flamingo) ૧૦૦-૧૫૦, મોટા હજ (Greater Flamingo)-૨૦૦-૩૦૦.

વિકટર પોર્ટ ઉપર:

મોટો ચકવો (Great Stone Plover) -૨, સરેદ વાખગલી (Gullbilled Tern) -૧૫-૨૦, સરેદ કંકણસાર (White Ibis)-૨

વિકટર સોલ્ટ વર્ક્સમાં :

બ્રાહ્મણી બતક (Brahminy Duck) -૧૫૦-૨૦૦, ગયલા (Shoveller) ૧૫-૨૦, રાતાપગ (Redshank) ૨૦.

ઘેરા ખારામાં:

પીળીચાંચ ઢોક (Painted Stork) ૨૫-૩૦ જેટલા હતા, જેમાં ૫-૬ બચ્ચાં પણ હતાં. નાનાં હજ (Lesser Flamingo) ૨૦૦-૩૦૦, મોટા હજ (Greater Flamingo) ૫૦૦-૬૦૦.

વિકટર સોલ્ટ વર્ક્સ પર જેની સતત દેખરેખના કારણે મોટા પાયે થતો પક્ષીઓનો શિકાર તહુન બંધ થયેલ, તેનું કદ્દી શકાય, તેવા મંગાભાઈ ધાપાએ છેલ્લા કેઢુંઅસી માસમાં ૧૦૦૦૦-૧૫૦૦૦ હજ-કરકરા આવેલ હોવાનું અને અત્યારે કુલ ૪૦૦૦-૫૦૦૦ જેટલા બસે પ્રકારનાં હજ હોવાનું જણાવેલ છે. મંગાભાઈ જેવા જ કોઈનાર નજીકના નાનાવાડા ખાતેનાં દિલીપભાઈ વાળા જેવા યુવાનના પ્રયત્નોનાં કારણે પાંચપીપળા ભરતી નિયંત્રક યોજનામાં આવતા ૨૦૦૦૦-૨૫૦૦૦ પક્ષીઓને સુરક્ષા પ્રદાન થયેલ છે.

તા. ૨૫/૨૬-૪-૦૪નારોજ 'રીફવોચ' સંસ્થાના સુદર્શન રોડ્રિક્સ સાથે, સુગાપાડા, તા. વેરાવળમાં 'મરીન સર્વે' માટે ગયેલ ત્યારે અમોએ પાંચપીપળા ભરતી નિયંત્રક યોજનાની મુલાકાત લીધેલ. આ કારાઅંકુશ યોજનાના બંધારામાં થોડું પાણી ભરેલ હતું, જેમાં ૧૫૦૦-૨૦૦૦ જેટલાં નાનાં હજ (Lesser Flamingo) અને ૩૦૦-૪૦૦ જેટલાં મોટા હજ (Greater Flamingo) બચ્ચાં સાથે હતાં. સાથે પીળીચાંચ ઢોક (Painted Stork) ૧૦૦-૧૧૦, ચમચા (Spoonbill) ૫૦-૬૦,

ગયલા (Shoveller) ૨૦-૨૫, ભગતડાં (Coot)-૧૦૦, ટીલિથાળી બતક (Spotbilled Duck) ૧૫૦-૨૦૦ જેટલી જોયેલ. તા. ૦૭-૦૫-૦૪ના રોજ એટલે કે બે અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં ગયેલ ત્યારે બંધારામાં પાણી સુકાઈ ગયેલ હતું. ભરતીનો ગાળો હોઈ બંધારામાં આવેલ કીડના ભીના વિસ્તારમાં ૮૦૦-૧૦૦૦ નાનાં હજ (Lesser Flamingo) જોયેલ. તા. ૨૫-૪-૦૪ સાંજે મૂળદારકાના દરિયાડિનારે અને ફિશિંગ કોલોનીમાં ગયેલ ત્યારે નાળિયેરીનાં વૃક્ષો ઉપર નાના કાજિયા ૫૦-૬૦ અને નીચે નિરનારી કાગડા (Jungle Crow) ના સહઅસ્તિત્વનો નજીરો જોયેલ. દરિયા ઉપર ઊડતી સરેદ વાખગલી (Gullbilled Tern) ૮-૧૦ જોયેલ.

વિકટર સોલ્ટ વર્ક્સ અને ખાડી વિસ્તારમાં શિકાર પ્રવૃત્તિ નાથવામાં મહત્વનાં ભાગ ભજવાતા મંગાભાઈ ધાપાએ હજ, કાજિયા, મોટી સંખ્યામાં આવાંના સમચાર આપતા એપ્રિલના અંતમાં વિકટર સોલ્ટ અને ખાડી વિસ્તારની મુલાકાત લીધેલ. વિકટર, ચાંચ અને કથીરવદર સોલ્ટ વર્ક્સ જાણે સાંજ થાય એટલે સુરખાબ નગરી બની જાય છે. આકાશ ચુલાબી દેખાય તેટલી સંખ્યામાં હજ જોવા મળેલ. વિકટર સોલ્ટમાં અંદાજે ૮ થી ૧૦ હજાર નાનાં હજ અને ૧.૫ થી ૨ હજાર મોટા હજ, ચાંચ સોલ્ટ વર્ક્સમાં ૪ થી ૫ હજાર નાનાં હજ અને ૫૦૦ જેટલા મોટા હજ, કથીરવદર સોલ્ટમાં ૩ થી ૪ હજાર નાનાં હજ અને ૫૦૦ જેટલાં મોટા હજ જોવા મળેલ. એમાનાં ૮-૧૦ % જેટલાં બચ્ચાં હોવાનું માનું માનું હતું છે.

વિકટર સોલ્ટના એક ક્યારામાં ૧૦૦-૧૫૦ મોટા હજ જોયેલ. આ પ્રવાસ દરમિયાન ચાંચ ગામની મુલાકાતનો પણ લાભ મળેલ. ત્રણોથ્ય બાજુ પાણીથી વેરાયેલ ચાંચબંદર પણ સાંજ થતા જાણે મોરનગરી હોય તેનું ભાસે છે. ગામનાં તમામ ઘર અને વૃક્ષો ઉપર મોરનાં દર્શન થાય છે. ચાંચ ખાતે વિષ્ણુ નામનો છોકરો સારો પર્યાવરણપ્રેમી છે. તેણે શિયાળામાં યાયાવાર પક્ષીશિકાર અને હાલમાં હજશિકાર સંપૂર્ણ બંધ કરાયેલ છે. એક અંદાજ પ્રમાણે ચાંચ ખાતે ૮ થી ૧૦ હજાર જેટલા મોર હશે. વિકટર સોલ્ટ વર્ક્સમાં પક્ષીનિરીક્ષણ કરતા હતા તે દરમિયાન ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા નાના કાજિયા એક સાથે ટોળામાં નીકળેલ.

તા.૦૭-૦૫-૦૪ના રોજ અમો ચીખલી સૉલ્ટ વર્ક્સની અને ખાઈની મુલાકાતે ગયેલ. સૉલ્ટ વર્ક્સમાં ૧૫૦૦-૨૦૦૦ જેટલા નાનાં હજુ, ૪૦૦-૫૦૦ મોટા હજુ જોતાં આનંદ થયેલ. સાંજ લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા નાનાં હજુ અને બે હજાર જેટલા મોટા હજુ ને સૉલ્ટ વર્ક્સ આવતા જોયેલ.

અમીત જેઠવા

મુ.પાંચા.જિ.અમેલી-૩૬૫૮૫૦

Thrush), ચકલી (House Sparrow), તાડ અભાલી (Palm Swift), હોલી (Little Brown Dove), કૈચીપુષ્ટ વૃબગલી (River Tern), સફદ કંકળસાર (White Ibis), કબૂત બગલો (Grey Heron), પેરખણી (Treepie).

આ ઉપરાંત, હાડેશ્વર મંદિરની બહાર લીમડાના જાડ પર લગભગ ૧૦૦૦ જેટલી વાગોળો જોવા મળેલી.

ડૉ. બી. એમ. પારાશર, નગીરભાઈ, ડૉ. સોહલ પટેલ, ડૉ. ગૌરવ એમ પંડ્યા, મધ્યાવાઈ પરીખ
આફાંડ

હાડેશ્વર મંદિર(કડીપાણી), વડોદરાથી કેવડીયા કોલોની

તા. ૧૦-૪-૦૪ના રોજ ચૌદ વ્યક્તિઓના જૂથે વડોદરા જિલ્લાના ડભોરીથી ઉપર, હાડેશ્વર મંદિર (કડીપાણી) થી કેવડીયા કોલોની, સરદાર સરોવર તેમ સુધીનું લગભગ ૭૫ ક્ર.મી. જેટલું 'બોર્ટિંગ' માઝું. કાર્યક્રમ પ્રમાણે બધા ઈમી તારીખે લગભગ અહીં રહેતે હાડેશ્વર મંદિર પહોંચી ગયા.

વહેલી સવારથી શરૂ થયેલા આ પ્રવાસ દરમિયાન તથા બીજે દિવસે કેવડીયા કોલોનીમાં જોવા મળેલા પક્ષીઓનું એક ચેક લિસ્ટ અહીં આપીએ છીએ.

શેતનયના (White-eye) (લીમડો અને બર્સોલી), ફડક ફૂકી (Ashy Wren Warbler)-૧, ધોખીડો (Large Pied Wagtail)-૧, ફાટીચાંચ ટોંક (Open-bill Stork)-૧, રાખોડિશિર ભોંઘયકલી (Ashycrowned Finch Lark)-૧, ધોડકાખર (Bank Myna)-૧૦૦, કંસારો (Coppersmith)-૧, બુલબુલ (Redvented Bulbul), નાના કાજિયા (Little Cormorant)-૨૦, શક્કરખોરો (Purple Sunbird), કાખરો કલકલિયો (Pied Kingfisher), મત્સ્યખોજ (Osprey)-૨, કચ્છી પિંડો (Brown Rock Chat)-૪, સર્પશ્રીવ (Darter)-૨૪, કાકડિયો કુંભાર (Crow Pheasant), રાજ (Yellowthroated Sparrow), સિરકીર (Sirkeer Cuckoo), તારોડિયા (Redrumped Swallow), અભાલી (Dusky Crag Martin), નીલ કસ્તુરો (Blue Rock

ઉમેટાથી વાસદનો 'ટ્રેક'

નેચર કલબ વેટરનીટી કોલેજ, આંશાં દારા તા. ૨૧-૦૩-૦૪ ના રોજ ઉમેટાથી વાસદ, મહીસાગર નદીના કિનારે એક 'ટ્રેક'નું આધ્યોજન કરવામાં આવેલું. આંશાંથી સવારે પોણા પાંચ વાગે નીકળી લગભગ ૭ વાગે વહેલી સવારનું આકાશ દર્શન કરી, ઉમેટાથી 'ટ્રેક' શરૂ કરવામાં આવ્યો. આ 'ટ્રેક' દરમ્યાન જોવામાં આવેલ મહત્વનાં પક્ષીઓની યારી અહીં આપીએ છીએ.

ગજપાઉ (Blackwinged Stilt), ટીલિયાળી બતક (Spotbill Duck), નાની બાટણ (Little Ringed Plover), નાનો સફદ બગલો (Little Egret), પીળકેપા (Yellow Wagtail), દિવાળીધોડો (White Wagtail), ધોખીડો (Large Pied Wagtail), ચેતવા (Garganey), ભોંઘયકલી (Ashy Crowned Finch Lark), ટિટોડી (Redwattled Lapwing), વગડાઉ ટિટોડી (Yellow wattled Lapwing), પ્રાણકી બતક (Brahminy Duck), રાજહંસ (Barheaded Goose), નાના કાજિયા (Lillite Cormorant), પંકુરખોરો (Purple Sunbird), બુલબુલ (Redvented Bulbul), રણ બુલબુલ (Whitecheeked Bulbul), કબૂત બગલો (Grey Heron), કાણી બગલી (Pond Heron), કાખરો કલકલિયો (Pied Kingfisher), સફદછાતી કલકલિયો (Whitebreasted Kingfisher).

સમગ્ર 'ટ્રેક' એક સારો અનુભવ રહ્યો. આ ઉપરાંત, 'બર્ડ વાંશિંગ' માટે પણ ત્યાં વિપુલ તકો મળી રહેતે રહે છે. ડૉ.

બી.એમ.પારાશર્ય સાથે રૂબરૂ ચર્ચા વખતે એમજો જાળાયું કે, એ વિસ્તારમાં ‘રાજહંસ’ અગાઉ તેમજો ક્યારેય જોયેલ નથી.

ડૉ.ડી.એન.રાંક, ડૉ.ગૌરવ એન. પંડ્યા
પાનેલિયા સંજ્ય એમ., અજ્ય ભાષાવારિયા
આધાંદ

આ ઉપરાંત તાં અન્ય પક્ષીઓમાં, ફૈપ્પ(Magpie Robin), ટપ્પીલો હોલો (Spotted Dove), આ બધાં તો હતો. જ. દૂર, ‘ક્રમાઉન્ડમા’ તેમનો અવાજ પણ સંભળાતો હતો.

વડોદરાના ‘બર્ડવોચ્સ’ માટે, મારા મતે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલનો બાગ પક્ષીનિરીક્ષણ માટેની એક સારી જગ્યા છે.

હોસ્પિટલમાં ‘બર્ડ વોચિંગ’!

તા. ૩૧-૦૫-૦૪ થી તા. ૨-૦૬-૦૪ દરમિયાન મારા એક સંબંધીને વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ. આ ગાળામાં હોસ્પિટલના ‘ક્રમાઉન્ડ’ માં પણ ખૂબ જ સરસ ‘બર્ડ વોચિંગ’ થઈ શક્યું. હોસ્પિટલના ક્રમાઉન્ડમાં સુંદર બગ્યાચો છે.

હોસ્પિટલના તાત્કાલિક સારવાર અને અક્સમાત વિલ્બાગનાં પ્રવેશદ્વારની બરોબર પૂર્વ દિશામાં પેલ્ટોફાન્ઝના જાડમાં સોનેરીપીઠ લક્કડખોદનો માળો હતો. જાણી એક સૂકી ડાળીના પોલાણમાં નર અને માદા વારાફરતી બચ્ચાને ખોરાક ખવડાવતાં હતાં. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર અને ‘એલેભીક ગલાસ ફેક્ટરી’ના જાંપાં વચ્ચેનાં જાડમાં ખેરખડા (Indian Treepie) પણ જોવા મળ્યા.

હોસ્પિટલના પાછળના ભાગમાં કેન્ટીન પાસે, એક દરજ્જા (Tailor Bird)નું જોહું તેનાં બચ્ચાં સાથે જોવા મળ્યું. નર અને માદા છૂટોં પડ્યાં ત્યારે આ બચ્ચાને પોતાનાં ગજ કરતાં મોટી એવી બિસકોલી પર તરાપ મારતા જોવાની ખૂબ જ મજા આવી.

સૌથી અચરજ પમાડે તેવી બાબતો એ હતી કે, તા. ૦૨-૦૬-૦૪ના રોજ સવારે લગભગ ૭.૦૦ વાગ્યે હું પાછળની કેન્ટીનના ‘રસ્તા પર’ બેઠો હતો તે દરમિયાન બાજુમાં કરેલ વાડમાં મારાથી લગભગ ૭-૮ કૂટ દૂર નવરંગ(Indian Pitta) આવીને બેઠો. ખૂબ અચરજ સાથે તેનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ તે થોડે દૂર ઊકાચો અને પાછો કરતાં કરતાં લગભગ અદેશ થઈ ગયો. આટલાં વર્ષોના પક્ષીનિરીક્ષણમાં અગાઉ ફક્ત બે જ વાર એટલે કે સાસણ-ગીરમાં અને ડાંગમાં નવરંગ જોયા બાદ પહેલો વાર વડોદરા જોવા શરેરમાં નવરંગ જોઈ અભીભૂત થઈ ગયો.

ખોડિયાર જળાશય પરનું પક્ષીનિરીક્ષણ

ધારીમાં મોટામાં મોટું ખોડિયાર જળાશય છે. બે મિત્રો, સુરેશભાઈ વેગડા અને ડાંગરભાઈ સાથે રહીને તા. ૧૦, ૧૧-૦૨-૦૪ના રોજ અમે પક્ષીનિરીક્ષણ માટે ગયા. ખોડિયાર જળાશયના મધ્ય ભાગમાં થોડી બેટા જેવી જગ્યા રહે છે. તેની આસપાસ પક્ષીઓને સારી સલામતી રહેતી હોવાથી મોટા ભાગનાં પક્ષીઓ આ તરફ જળવિહાર તેમજ નિવાસ કરે છે. તેમાં ટિવાળીઘોડા (White Wagtail) ૨૦ થી ૨૫, પીતશિર પીળકિયા (Yellowheaded Wagtail) ૭૫, કેરીપુંછ વાખગલી (River Tern) ૩, મોટી વાખગલી (Caspian Tern) ૨, કાંઠલાવાળી નાની ઢોંગીલી (Little Ringed Plover) ૧૦, નાનો કાજિયો (Little Cormorant) ૨૦૦, નકટા (Comb Duck) ૨૫૦, લાંઘી ધોમડા (Brownheaded Gull) ૧, નાના તેજપર (Small Indian Pratincole) ૨૧૦, કાબરી કારચિયા (Tufted Pochard) ૩૫૦, ભગવી સુરખાબ (Ruddy Shelduck) ૬, નાની મુરથાબી (Common Teal) ૨, સીંગપર (Pintail) ૨,

આ ઉપરાંત તા. ૩૦, ૩૧-૧-૦૪ના રોજ કેવીપુંછ વાખગલીનાં બે બચ્ચાં જોવા મળ્યાં. આગળ જતાં મોટા ચકવા (Great Stone Plover)ના બે ઈડા જોયા, તેમનો ‘ફોટોગ્રાફ’ લીધો. (કાબરી કારચિયાની સંખ્યા ઘડી મોટી કહેવાય. ખૂબ મોટા વિસ્તારમાં પાણી ઉંઠું હશે, તેમ સુચયે છે.-સ.)

શ્રી અજ્ઞત ભલ

કે.બ્સ ટેપોની પાસે, સરદારનગર-૨, ભાર્વાજ મુ. ધારી-૩૬૫૬૪૦

ભાવનગર જિલ્લામાં પક્ષીનિરીક્ષણ

ભાવનગર જિલ્લાના પાલિતાશા શહેરની પાછળ, જે સર અને મહુવા તાલુકાની વચ્ચેના વિસ્તારમાં રાણીગાળા નામની એક વીજી (રિઝવ્ ફારેસ્ટ) આવેલી છે. અહીં ચારે બાજુ નાનીમોટી ટેકરીઓની હારમાળા જોવા મળે છે. આ ટેકરીઓની વચ્ચે આ વિસ્તાર એકદમ રમડીય દૃશ્ય ઊંઠું કરે છે. ટેકરીઓમાંથી એક-બે નાની નદીઓ પણ વહે છે. ચોમાસા દરમિયાન આ નદીઓમાં પાકી વહેતું થાય છે અને આખા વિસ્તારમાં હરિયાળી થઈ જાય છે. આ જંગલ વિસ્તારમાં મોટા ભાગે ધાસ, ગાડો બાવળ, ખાખરો, વિકણો, દેશી બાવળ, બોરડી જેવી વનસ્પતિ જોવા મળે છે. સાથે પક્ષીઓ એટલાં કે મન મૂકીને માણવાની હિચ્છા થઈ જાય ! આ વિસ્તારના વન અવિકારીની જાણકારી મુજબ ૧૦-૧૫ જેટલા સિંહોની વસ્તી પણ છે. સાથે ચિકારા, નીલગાય, ચિતલ, જંગલી ભૂંડ વગેરે પણ જોવા મળે છે.

તા. ૨૫, ૨૬-૦૮-૦૮ એમ બે દિવસ દરમિયાન અમે ગ્રાસીશાખ વિભાગના બીજા ગીજા વર્ષના ૨૦-૨૫ વિદ્યાર્થીઓએ ડૉ. આર્થ. આર. ગઢવી સાથે આ વિસ્તારની મુલાકાત લીધી. આ બે દિવસની મુલાકાત દરમિયાન અમોને નીચેના પક્ષીઓ નિહાળવા મળ્યા.

નાની સિસોટી બતક (Lesser Whistling Teal), કપાસી (Blackwinged Kite), તલિયો તેતર (Painted Partridge), વર્ષા લાવરી (Rain Quail), વન ભડકિયું (Jungle Bush Quail), ચાતક (Pied Crested Cuckoo), બપૈયો (Common Hawk Cuckoo), દશરથિયું (Indian Nightjar), દૂધરાજ માદા ની (Paradise Flycatcher), નાની પાનટીકીટી (Streaked Fantail Warbler), તલિયું ટપુણિયું (Spotted Munia), થોરિયો ગંદમ (Greynecked Bunting), કુજ (Common Crane)

વાંદેલા વિરલ એમ.

પા. પી. ઇન્સ્ટી. ઓફ સાયન્સ, ભાવનગર

૦૭૯-૦૭૨

બાન્ડીયાબેલી ખાતે પક્ષીનિરીક્ષણ

અમે માંડવ વીડમાં આવેલ બાન્ડીયાબેલી નામની

જીવાએ જે પક્ષીઓ જોવા તે નીચે મુજબ છે.

તારીખ:-૮-૫-૦૮

સ્થળ:- બાન્ડીયાબેલી (ચોટીલા- થાનના રસ્તે, ચોટીલાથી ૧૮ ક્ર.મી.ના અંતરે)

સમય:-સવારે ૬:૩૦ થી ૮:૦૦

પક્ષીઓ:-માધ્યિયો (Honey Buzzard)-૨, (હિલ્લા એક વર્ષથી બને સાથે દેખાય છે), સાપમાર (Short-toed Eagle), શકરો (Shikra), કપાસી (Blackwinged Kite), મોટો પટરંગો (Bluecheeked Bee-eater), નાનો રાખલાલ (Small Minivet).

ત્યાં, ગોરડ (Acacia senegal)ના એક ઊંચા ઝડની ટોચ ઉપર મોટો માળો દેખાયો. માળની નીચેની જમીન ઉપર જે ચરક (હગાર) પહુંચું હતું, તેમાં વાળ અને હડકાં મળ્યા. માળમાં પક્ષીઓ નહોતા, પરંતુ તે ચોક્કસ શિકારી પક્ષીનો હોવો જોઈએ તેમ લાગ્યું. (વાળ અને હડકાં, મોટામાંથી બહાર કાઢેલી લખોટી(Pellon)માં જોવા મળે. -સ.-)

માધવપુર આશ્રમમાં પક્ષીનિરીક્ષણ

તારીખ ૧, ૨, ૩ માર્ચ, ૨૦૦૪ના દિવસોમાં માધવપુરસ્થિત ઓશો આશ્રમમાં રોકાવાનું થયું. ત્યાં ગોવિદભાઈ વેકરિયા અને રેવતુભા રાયજાદાનો સંગાથ મળ્યો જેથી પક્ષીનિરીક્ષણ કરવામાં ખૂલ જ મજા આવી. આશ્રમ અને તેની આજુબાજુના વિસ્તારમાં દૂધરાજ (Paradise Flycather), મોટો કાળો ઝુમસ (Greater Spotted Eagle) સોનેરીપીઠ લક્કડખોડ (Goldenbacked Woodpecker), ભગવી સમડી (Brahminy Kite), ચીભરી (Spotted Owlet), દૈયડ વગેરે પક્ષીઓ જોવા મળ્યા.

આશ્રમનાં જાડ ઊંચા અને ઘટાદાર હોવાને કારણે સાંજે સેંકડો પોપટ (Roseringed Parakeet) ત્યાં ચાતવાસો કરવા આવે છે. ચાંચ નાખવાથી ઘડા તેતર અને લંબડા પણ ખાવા આવે છે.

પૈવાં હાથી, ડૉ. આર. દેવકર
“ધીવત” ૧/૧૦ એસ્ક્રોન સોસાયટી, અમીન માર્ગ, રાજકોટ-૧

કોલાહલ વચ્ચે બુલબુલનો માળો

માનું નામ નાન્સી છે. હું પક્ષીમાં ખૂલ જ રસ ધરાતું થું. મેં મારી આજુબાજુ કરેલા નિરીક્ષણની નોંધ મોકલાવું થું.

મારી કોલેજ, ગવર્નન્ટ પોલિટેકનીક'ના ૮ નં. ના વર્ગમાં બારી ઉપર, પડદાની 'પેલમેટ' પર બુલબુલે માળો કરેલો હતો.

આ વર્ગમાં લગભગ ૫૦ થી ૬૦ વિદ્યાર્થીઓ હોય છે અને ત્યાં સતત અવાજ રહેતો હોય છે, પણ આવા કોલાહલ અને આટલા માણસોની વચ્ચે પણ બુલબુલે પોતાનો માળો બનાવ્યો, તે જોઈને નવાઈ લાગી.

હવે તો બુલબુલના જે બે બચ્ચાં હતાં તે પણ ઊરી ગયા છે, પરંતુ માળો જેમનો તેમ છે. મેં, જ્યારથી બુલબુલે માળા બાંધવાની શરૂઆત કરી ત્યારથી એના બચ્ચાં ઊરી ગયા ત્યાં સુધી નિરીક્ષણ કરેલું છે.

બુલબુલ આમ તો સામાન્ય પક્ષી ગણાય પણ તે માણસો સાથે આટલી હદે ભળી ગયું છે, તે મારા માટે નવાઈની વાત છે. (તારીખ ? -સ)

નાન્સી વોરા

દરિધામ, જલારામનગર-૧, રાજ્વનગર, પોરંદર

ભીમરાજ (Rocket-tailed Drongo)ના માળા

તા. ૨૪-૬-૦૪ના રોજ 'બોટનિકલ ગાર્ડન', વધઈ, ડાંગ ખાતે બે ભીમરાજના માળા જોયા. એક માળો આશરે ઉપ થી ૪૦ ફુટની ઊંચાઈ પર નીલગિરિના ઝાડ પર હતો, જ્યારે બીજો માળો પનવેલના ઝાડ ઉપર આશરે ૧૫ થી ૨૦ ફુટની ઊંચાઈ પર હતો. આ ઝાડના થડની ખરબચઢી સપાટીને ભીમરાજ, ચાંચ તેમજ પગના નખ વડે લીસી કરતો હતો. કદાચ સાપ જેવા સરિસુપોથી બચવા આવો પરિશ્રમ કરવો પડતો હશે? જ્યારે નીલગિરિનું થડ તો લીસું જ હોય છે. આપ આ બાબતે વધારે પ્રકાશ પારી આભારી કરશોજુ.

મુકેશ આચાર્ય

૧૨, સાગર કોમ્પ્લેક્સ, વસ્ત્રાપુર તળાવાની સામે, અમદાવાદ-૫૮

કુરન (કચ્છ) પાસે પક્ષીનિરીક્ષણ

તા. ૨૨-૨-૦૪ના રોજ કુરન, જ્યાં ૫૦૦૦ વર્ષ પૂર્વના હડપણ સંસ્કૃતિના અવશેષોનું સંશોધન ચાલે છે, ત્યાં હું અને શાંતિભાઈ વરુ ગયા હતા. રસ્તામાં વેકરિયા ઢંઢ પાસે ૨ ધોળવા ગુમ્મસ (Twany Eagle) જોઈ. કુરન પાસેથી ઉડતી ૨૦૦૦ પેણ (Rosy Pelican) જોયા. કુરનથી ઉત્તરમાં રણમાં બીજી ૫૦૦૦ પેણ હતી. કુરન પાસે એક બદામી ગીધ (Griffon Vulture), એક તુરુમ્ભી (Kestrel) અને એક ચોટીલી પેણ (Dalmatian Pelican) ઉડતાં જોયા.

અચિન પોમલ

પોમલ જ્યેલર્સ, વોકણા ચોક, સુજ ૩૭૦૦૦૧



નરારા ટાપુ પાસે પક્ષી નિરીક્ષણ

તા. ૨૭-૧૧-૨૦૦૩ના રોજ WWF રાજકોટ દ્વારા નરારા જવાનું થયું. નરારામાં દરિયાઈ સૂછિ તો જોવા મળે જ છે સાથે પક્ષીઓ પણ ઘડી સંખ્યામાં જોવા મળે છે. નરારા પહોંચતા પહેલા બન્ધે તરફ મીઠાના અગરિયા આવે છે. ત્યાં વારંવાર કાળીડોક ટોંક (Blacknecked Stork) જોવા મળે છે. આજે પણ એક કાળીડોક ટોંક જોવા મળ્યો. પાન પડીઈ (Marsh Harrier)-૧, ભગવી સમીક્રીણ (Brahminy Kite)-૨, મોટા હંજ (Greater Flamingo)-૪, નાનાં હંજ (Little Flamingo)-૩૦, ચુલાબી પેણ (Rosy Pelican) -૬૫, મોટા કાજિયા, સર્પશ્રીવ (Darter), ગયડા (Shaveller), સિંગપર (Pintail), ટીલિયા (Ruff), કીચડિયા, કાળી કીચડિયા, ટર્ન સ્ટોન (Turnstone), દરિયાઈ બગલો (Reef Heron), કબૂત બગલો (Grey Heron), કાળાપગ કીચડિયા તેમજ ન ઓળખી શકાય તેવા અસંખ્ય કાદવ ખૂંદનારા પંખી (Waders) ત્યાં જોવા મળ્યાં.

બાવેશ ત્રિવેદી

૪૨, માલવિયાનગર, ગોડલ રોડ, રાજકોટ ૩૬૦૦૦૪



મૃત ધૂવડ

તા. ૨૨-૧-૦૪ના રોજ હું, ચિકુ વોરા, ફારુક ચૌહાણ, વિશાળ થોરિયા તથા મૃણાંત ચાવડા નાયકા તેમની મુલાકાતે ગયા હતા. ત્યારે નાયકા તેમે જવાના રસ્તામાં અમે એક સંકેદ રંગનો થેલો પહેલો જોયો. નજીક જઈને જોતાં

જોયું તો તે બંધ હતો. થેલો ખોલતા અંદરથી એક ધૂવડ મરેલી હાલતમાં મળ્યું, જે અમે સુરેન્દ્રનગર રી.એફ.ઓ. શ્રી.જોથી સાહેબને સુપરત કર્યું. બે વર્ષમાં ત્રણ ધૂવડ મરેલી હાલતમાં અમે કંઈ કર્યા છી. જો આ જ રીતે ધૂવડ મર્યાદ કરશે તો ધૂવડોનાં અસ્તિત્વ જ નહીં રહે.

ધૂપડ વિષેની અંધશ્રદ્ધાને દૂર કરવા અમે બધાને વિનંતી કરીએ છીએ.

योगेन्द्र शाह, चिकु वोरा
सुरेन्द्रनगर

અમદાવાદમાં કચ્છી પિટો

મારા ઘરની બાજુમાં જ ખુલ્લુ મેદાન છે આથી
અવારનવાર અવનવાં પક્ષીઓ જોવા મળે છે.

મારા ધર પાસે, જાન્યુ. ૦૪ દરમિયાન કંઈ પિછો (Brown Rock Chat) જોવા મળે છે. પહેલા તો તેને જોઈને દેવચકલી (Indian Robin) ની માદા જેવો જ ભાસ થયો, પરંતુ તેનું થોડું મોટું કંઈ અને પૂંછણી નીચે લાલ રંગનો અભાવ મને સતતાવતો હતો. આપરે પાંચ-છ દિવસ સુધી પક્ષીઓ વિષેનાં વિવિધ પુસ્તકો ઉથલાવ્યા બાદ, શ્રી ડારિનારાયણ આચાર્ય (વનેચર)ના પુસ્તક 'વનવગડાના વાસી'માંથી મળી આવ્યું, કે કંઈ પિછાને પહેલી નજરે જોતા દેવચકલીની માદા હોવાનો ભ્રમ અવશ્ય થાય. તે પછી નક્કી થઈ ગયું કે તે કંઈ પિછો જ છે. બીજુ કંખુંબારી ૦૪ પછી તે નથી દેખાયો.

ભૌમિક શાહ

૪૧, મલિકરાતનામ્ય-૧, પી. એન્ડ ટી કોલોની રોડ, વાસણા, અમદાવાદ
૩૮૦૦૦૭

 શક્કરખોરાની સંશોધણા

વિહંગના મિગ્રો અને વડીલો માટે એક અવિસમરણીય અનુભવ લખી મોકલું છું. ગયા ચોમાસાની વાત છે, તે દિવસે સવારથી ધોખમાર વરસાદ પરી રહ્યા હતો. અમે બધા જ બારી બારાળા વગેરે બંધ કરી ઘરમાં બેઠા હતા. તાં દૂધવાળો આવ્યો અને મમ્મી દૂધ લેવા બહાર નીકળી. દૂધ લઈને આવતા મમ્મીએ મને બહાર બોલાવ્યો. મેં જોયેંટું તો એક શક્કરાખોરો (Purple-rumped

Sunbird) પાણીમાં હતો. તે ટિવસે ખૂબ વરસાદ હતો અને પાણી આખા અંગણામાં વહીને જતું હતું, પણ પગથિયા પાસે ખૂણાને કારણે પાણી સ્થિર હતું. ત્યાં શક્કરખોરો જેમ-તેમ કરીને સપાઠી પર રહ્યો હતો. મને નવાઈ લાગી, કારણકે વરસાદ એટલો ધોખમાર હતો છતાં તે સપાઠી પર રહી શક્યું. મેં તરત એને હથેળીમાં સાચવીને ઊંચકી લીધો. તેનાં પાણી સંપૂર્ણ રીતે પલળી ગેયેલા હતા. પહેલા તો સમજ ન પડી કે તેને સૂકું કિરી રીતે કરવું કે જેથી તેના પીછાને નુકશાન ન થાય. ત્યાં વિચાર આવ્યો કે છાપાનો ઉપયોગ કરું અને તે કાગિયાબ રહ્યું. પેપરની નાની પડી ફાનીને તેનાથી સતત તેના શરીર પરથી પાણી ચૂસતો ગયો અને લગભગ પંદર-વીસ મીનીતામાં તે સંપૂર્ણ રીતે કોરું થઈ ગયું. જ્યારે તેને પાણીમાંથી ઊંચક્યું હતું, ત્યારે તેની આંખોમાં અલગ ભાવ હતા પણ હવે તેની આંખોમાં થોડી તાજગી અને ચમક દેખાયા. હવે તે સૂકું તો થઈ ગયું પણ ખૂબ જ નભયું દેખાતું હતું. પાણીમાં બચવા મારે તેની બધી શક્તિ વપરાઈ ગઈ હશે તેથી એમ હશે. હવે તેને કિર્દિક ખવડાવવું જોઈએ, એવો વિચાર આવ્યો પણ ખવડાવયું શું? શક્કરખોરને ધરના અંગણામાં જસુદ્ધાના ત્રણ-ચાર છોડ પર ખીલેલાં કૂલમાંથી વારાફરતી ચાંચ ધૂસારી કૂલનો રસ પીતા ઘણી વાર જોયેલા એટલે વિચાર આવ્યો કે મધ્ય ખવડાવવું જોઈએ. એક નાની નીશમાં મધ્ય કાઢી તેની આગળ ધર્યું તો તેને અડકયું પણ નહીં. થોડી વારે વિચાર આવ્યો કે કૂલમાં તો મધુરસ પાતળો હોય છે. એક બીજી નીશમાં થોકું પાણી લીધું અને તેમાં થોકું મધ્ય ઉમેરી પાતળું નિશ્ચાશ બનાયું, અને એની આગળ ધર્યું, પણ તોથે તેણે ખાંધું નહિ. પછી મેં આંગળી પર એ નિશ્ચાશ લગાડી તેની ચાંચની ટોચ પર થોકું લગાડયું અને આશર્ય સાથે તેણે પાતળી દીરી જેવી સફેદ જીબ ચાંચ પર ફેરવી ચાટી લીધું. તેની જીબ જોઈ મને ક્રીડિભાઉનું સરણ થયું. ક્રીડિભાઉનું જીબ એવી જ હોય છે. પછી તો મને ખૂબ જ મજા પડી. મધ્યવાળા નિશ્ચાશમાં આંગળી બોળીને હું તેની આગળ સામે ધંડું અને તે સફેદ લાંબી પાતળી જીબ બહાર લબકાવીને આંગળી ચાટી જાય. આ રીતે થોડી વાર ચાલ્યું. પછી ધરાઈ ગયું હશે, એટલે એંઝો ખાવાનું બંધ કર્યું. હવે તે ખૂબ જ ચેતનવંતુ લાગતું હતું અને આજુબાજુ જોઈ રહ્યું હતું. ત્યાં તો તેણે ચીરપરિચિત સીટી વગાડી. તેની સીટી ખખ જ ઉત્સાહપેરક હોય છે. એકદમ ખશી વ્યક્ત કરતાં

હોય તેવું લાગે છે. થોડી વાર પછી તો ઊરીને પંખા ઉપર બેસી ગણ્યું. ત્યાંથી ઊરીને બારણા ઉપર અને બીજે બધે ઉહાઉિડ કરવા લાગ્યું, એટલે સમજાયું કે હવે તે સ્વસ્થ છે, અને આવજો કહેવાનો સમય છે. હું બારણ્યું ખોલી, બહાર ઓટલા પર જઈ ઊભો રહ્યો. થોડી વાર હાથમાં રહી આમતેમ નજર દોડાવી જોતું રહ્યું અને પછી અચાનક સીટી વગાડ્યું ઊરી ગણ્યું. તે દરમિયાન વરસાદ બંધ થઈ ગયો હતો એટલે મને પણ ચિંતા ન હતી. હજુ પણ જ્યારે જ્યારે આંગણામાં જાસૂદના ફૂલોમાંથી શક્કરખોરા ને રસ ચુસ્તા જોઉં હું ત્યારે આ ડિસ્સો યાદ આવી જાય

કંસારા સાથે મુલાકાત

એક દિવસ બપોરે લગભગ બાર વાગ્યે કોલેજથી આવતા રસ્તામાંથી ક્યાંક લક્કડખોદ લાકું કોરતો હોય તેવો અવાજ આવતો સંભળાયો. ધ્યાનની જોયું તો, કોઈક પક્ષી એક નાંસી સૂકી ડાળીમાં ચાંચથી સતત લક્કડખોદની જેમ ઘા કરતું દેખાયું. તે સાથે જ દુક દુક એવો મીઠો અવાજ પણ સંભળાયો. સૂરજનો તડકો ઉપરથી આવતો હતો તેથી તેનાં રંગ રૂપ બરાબર જોઈ ન શક્યો. જાડની નજીક જ કોલેજ બિલ્ડિંગ હતું અને એ ડાળી અગાશીની નજીક હતી, એટલો હું અગાસ્તી ઉપર ગયો અને ત્યાંથી સલામત અંતર રાખી જોયું તો, પીઠ ઉપર ભભકદાર લીલો રંગ અને આંખ પાસે લાલ રંગ ધરાવતું નાનું પક્ષી એક સૂકી ડાળીમાં લક્કડખોદની જેમ ચાંચથી કાણું પારી રહ્યું છે. એની એકદમ નજીકની ડાળ પર એના જોયું જ પક્ષી બેઠા બેઠા ડેક ડાબે જમજો છાથાથી ફેરવે અને “દુક દુક” એવો મીઠો અવાજ સતત કરતું જાય. આ રીતે ડાલી જમજોની તરફ ડેક ફેરવતી વખતે મધ્યમાં ડેક નીચે કરે અને તે જ વખતે “દુક” એવો અવાજ કરે. પક્ષીનો રંગ એટલો મોહક અને અવાજ કાનને એટલો સરસ લાગતો હતો કે થોડી વાર ત્યાં જ ઊરી રહીને સાંભળ્યા કર્યું. પછી નજીકથી જોવાની લાલચમાં આગળ ખસવા ગયો પણ નીચે સૂકી પાંડાં કચડાવાનો અવાજ સાંભળતાં જ તેમની છિયામાં ખલેલ પડી, અને વારાફરતી બસે પક્ષી દૂરની ડાળીએ ઊરી ગયા. ઘરે આવીને ચોપડીમાં જોતા કંસારા તરીકે ઓળખ્યા. મેં પહેલી જ વાર તેમને જોયા એટલે એ અનુભ્યવ સ્મરણ પટલમાં અંકૃત થઈ ગયો છે. ‘The Book Of Indian Birds’ માં પ્રજનનની

ત્રણું, જાન્યુ. થી જૂન લખ્યું છે. શું તેઓ સૂકી ડાળીમાંથી જીવડા શોધીને ખાતું હશે કે પછી માળો કરવા માટેની તૈયારી હશે? ડાળીની ઊંચાઈ આશરે ૩૦-૩૫ કૂટ હશે.

વિચાગ પટેલ

ડી/૫, સ્ટાફ ક્વાર્ટર્સ, જાન્યુ કેમ્પસ, નવસારી ૩૮૬૪૫૦

• • • • •



બપૈયાનું ગુજરાતમાં પ્રજનન : બે પરોક્ષ અવલોકનો

બે પ્રસંગોએ મે, અપુષ્ટ બપૈયા(Indian Hawk Cuckoo)ને વર્ષ ૨૦૦૩ના શિયાળા દરમિયાન જોયા. આ બે અવલોકનોથી તે અર્દી પ્રજનન કરે છે તે તથા ક્યા પક્ષીના માળામાં ઈડાં મુકે છે, તે વિષેની માહિતી અર્દી આપું છું. પ્રથમ ડિસ્સામાં, મેં લેલાંના સતત અવાજથી દોરાઇને ઈન્દ્રોડા પાર્કમાં પાકની ઓફિસના સામેના ભાગમાં બાવળિયાની વચ્ચે એક અપુષ્ટ બપૈયાને જોયો જે ખાવાનું માંગતો હતો (food begging). તેના ઓરમાન મા-બાપ હતાં લેલાં. લેલાં કંયાં હતાં તે યાદ નથી રહ્યું, પણ લગભગ વનલેલાં (Jungle Babbler) હતાં. જો કે ત્યાં મોટા લેલાં (Large Grey Babbler) પણ જોવા મળે છે.

બીજા ડિસ્સામાં, થોળ પક્ષી અભયારણ્યના ભીમાસણ તરફથી જવાના ઓ.એન.જી.સી. કૂવાના રસ્તાની બાજુએ અપુષ્ટ બપૈયો જોયો. બસે ડિસ્સામાં ચાંચની પીળાશ પડતી ગુલાબી ચામરી તથા રંગરૂપ અપુષ્ટ પક્ષીનાં હતાં તે નિર્વિવાદ છે. બીજા અવલોકનની તારીખ હતી ૧૦-૧૨-૦૩. બપૈયો તેના અવાજને કારણે ચોમાસામાં ધ્યાન મેળે છે. ત્યાર બાદ શાંત હોવાને કારણે કણાતો નથી. ચોમાસામાં તે લેલાં કૂળનાં પક્ષીઓના માળામાં ઈડાં મુકી અલોપ થઈ જાય છે અને બચ્ચાં મોટા થયા બાદ શિયાળે નજરે ચે છે. અન્ય આવાં અવલોકનો નોંધય તો વધુ માહિતી મળે.



થોળ ખાતે સંકેદ ઢોક તથા ત્યાંનાં શિકારી પક્ષીઓની સમૃદ્ધિ વિષે

૧લી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ થોળ અભયારણ્યની મુલાકાતે ગયેલ ત્યારે ભીમાસણ તરફના કાંઠે અવલોકન કરતાં ઘણા બધાં પીળાચાંચ ઢોક (Painted Stork), શાટીચાંચ ઢોક (Openbill Stork)અને અન્ય જળપક્ષીઓની

વચ્ચે લાલ ચાંચવાળા સુંદર તથા ઝતુમવાસી સંફેદ ટોક (White Stork) નજરે ચડ્યા. માત્ર ગ્રાંજ પક્ષીઓ હતાં. આ ઉપરાંત ૧૯૮૮-૮૯ (વર્ષ ચોક્કસ નથી, પણ અવલોકન અને આંકડો બરાબર છે) શિયાળામાં નળસરોવરના રસે મેં તથા રાજેશ શાહે લગભગ ૧૦૦ સંફેદ ટોક જોયાં હતાં.

ડિસે.થી ફેબ્રૂ.૦૪૩૦ ગાળામાં થોળની ગ્રાંજ - ચાર મુલાકાતો દરમયાન ૨૦ થી યે વધુ શિકારી પક્ષીઓ જેમાં મત્સ્યભોજ (Osprey), પાનપણાઈ (Marsh Harrier), મોટો કાળો જુમ્બસ (Greater Spotted Eagle), મધ્યિઓ (Honey Buzzard), ધોળવો જુમ્બસ (Tawny Eagle) શકરો (Shikra), કપાસી (Blackshouldered Kite) એમ ઉથી ૮ જાતિઓનો સમાવેશ થાય છે. મોટા કાળ જુમ્બસની સંખ્યા પાંચ જેટલી નોંધાઈ છે, જે ઉલ્લેખનીય છે. આ પક્ષી 'બર્ડલાઈફ ઈન્ટરનેશનલ' દ્વારા વૈશ્વિક સત્ત્રે

સંકટગ્રસ્ત જાહેર થયેલ છે. શિકારી પક્ષીઓનું આ વૈવિધ્ય તથા તેમની સંખ્યા થોળ અભયારણ્યના તંહુરસ્ત નિવસનતંત્ર તરફ પણ કદાચ સંકેત કરે છે. આ ઉપરાંત અર્દી સંફેદપીઠ ગીધ (Whitebacked Vulture), કાળો શાહીન (Shahin), શિયાળુ સાંસાગર (Booted Eagle) તથા મત્સ્ય ધૂપડ (Brown Fish Owl) પણ નોંધાપેલ છે. વળી ચીભરી (Spotted Owlet) તથા ખેરો (Scavenger Vulture) તો ખરા જ. નજીકમાં ડાબલા ખાતે કાર્તિક શાસ્ત્રીએ પરદેશી ધોળવો જુમ્બસ (Steppe Eagle) પણ નોંધેલ છે. આમ, પંદરથીએ વધુ જાતિનાં શિકારી પક્ષીઓ સાથે થોળની સરખામણી રાજ્ય કે રાષ્ટ્રના અન્ય કોઈ પણ જલખાવિત હૈન્ટ સાથે થઈ શકે એમ છે.

પ્રશ્ન નિવેદી

૧૮, સુકોમલ ફ્લેટ્સ, રામદેવનગર, અમદાવાદ ૩૮૦૦૧૫

• • •

ગીધ પર જાપતો

* કચ્છમાં ગીધની વર્તમાન પરિસ્થિતિ

કચ્છમાં દરેક વર્ષ પહેલા ગીધની સંખ્યા સારી હતી, જેમાં સંફેદપીઠ ગીધ તથા ખેરો સામાન્ય હતા, જ્યારે બદામી ગીધ તથા રાજગીધ અલભ્ય હતા. શિયાળામાં શાહી ગીધ હંદ નજીક અચૂક જોવા મળતું. કચ્છમાં ગીધની જાતવાર માહિતી આ પ્રમાણે છે.

(૧) રાજગીધ (King Vulture)

ડો. સલીમઅલીએ તેમની મોજણી દરમયાન આ પક્ષીને ખાસ નોંધું ન હતું. કચ્છમાં કાળો તુંગર, ભીમાસર તા. અંજાર, ભુજ તાલુકાના કુકમા તથા માધાપર ગામ, ભુજની ખારી નદી, ટાપુર તેમ વિગેરે જગ્યાએ આ લખનારે તેને જોપેલ છે. છેલ્લે જાન્યુઆરી ૨૦૦૦માં તે ભીમાસર અને ટાપુર વચ્ચે અન્ય ગીધો સાથે જોવા મળેલ, ત્યાર બાદ નજરે પહેલ નથી. આમ હવે તે અલભ્ય છે.

(૨) બદામી ગીધ (Griffon Vulture)

ડો. સલીમઅલીએ પણ તેને સામાન્ય કહું ન હતું. તે કચ્છમાં સામાન્ય રીતે શિયાળામાં જોવા મળે છે. અગાઉ

તે શિયાળામાં સારી સંખ્યામાં જોવા મળતું.

છેલ્લાં ગ્રાંજ વરસમાં તે ફક્ત બાલાસર (તા. રાપર). બુડીયા ગામ (તા. અબડાસા), હુરન (ગચ્છમ) તથા ભુજ તા.ના રૂમાતા તેમ ખાતે જોવા મળ્યું છે. આમ તે કચ્છમાં હવે અલભ્ય છે.

(૩) શાહી ગીધ (Cinereous Vulture)

કચ્છમાં આ ગીધ શિયાળુ મુલાકાતી છે. તેની કચ્છમાં છારી ઢંઢ, ભીમાસર, ધીંધોખર કુંગર પર નોંધ થયેલ છે. છેલ્લે તા. ૨-૩-૮૮૩૩ રોજ એક પક્ષી જાણો નજીક જોવા મળેલ, જે કવિ તેજ તથા અચ્છિન પોમલે જોપેલ. ત્યાર બાદ તે જોવા મળેલ નથી. આમ તે અલભ્ય છે.

(૪) ખેરો (Scavenger Vulture)

દરેક વર્ષ પહેલા આ ગીધ કચ્છમાં સામાન્ય હતા અને સર્વત્ર નજરે પડતાં. તેના અપુખ પણ જોવા મળતાં, જે તેનું પ્રજનન થતું, તે સૂચવે છે. હાલ આ પક્ષીને કચ્છમાં જોવું દુલખ છે.



ગોદ પર જાપતો

આ લખનારે અગાઉ તેને અબસાડા તાલુકામાં ૧૮-૦૩-૨૦૦૪ ના રોજ જોયેલ. તા. ૪-૭-૦૪ રોજ ભચાઉ નજીક લોધેશ્વર દોરવાડા પાસે, પ્રાઇનાં મૃતદેહો નજીક ગ્રણ અપુષ્ટ વયના બેરા જોયેલ.

તેના ઓછા થઈ જવાનું કારણ, %તુનાશક દવા ઉપરાત સંડાસની સગવડો થઈ ગઈ છે, તે છે. કારણ કે, માણસનું મેળું ખાવું તેનો પ્રિય ખોરાક છે.

(૫) સફેદપીઠ ગીધ (Whitebacked Vulture)

કચ્છમાં આ ગીધ અગાઉ ખૂબ સામાન્ય હતું, હાલ તે અબડાસા તાલુકા સિવાય અન્ય તાલુકામાં અસામાન્ય છે. આ પક્ષીઓની સંખ્યા ઓછી થવાનું કારણ જંતુનાશક દવાનો ઉપયોગ, વાઈરસ, જાડની ઘટતી સંખ્યા વગેરે હોય તેમ લાગે છે.

હેલાં ગ્રણ વર્ષ દરમિયાન તે અબડાસા તાલુકામાં સારી સંખ્યામાં જોવા મળેલ છે. વધુમાં વધુ ૨૬ ગીધ તા. ૧૧-૮-૦૨ના રોજ રેલિયા મંજલ અને વિંગાણ વચ્ચે જોવા મળેલ. નલિયા તથા જ્ખૌમાં તો તે મકાન પર હજી પણ માળા બાંધે છે. તા. ૨૫-૦૬-૦૨ના રોજ જ્ખૌમાના મકાન પરના માળામાં ગ્રણ જુવાન પક્ષીઓ જોયેલ. તા. ૨૮-૧૧-૦૨ના રોજ ભુજ તાલુકાના, પચ્છમના રબવીરી ખાતે તેનો માળો જોયેલ.

હેલાં ગ્રણ વર્ષમાં, છારી હંદ ખાતે બે વાર, નીંગાળ ખાતે એક વાર, ભુજ તાલુકાના રતિયા ગામ તથા પચ્છમના રબવીરી ખાતે એક વાર આ ગીધ જોવા મળેલ છે. એમ લાગે છે કે, અબસાડા તાલુકામાં તેની સંખ્યા સારી છે. તા. ૨૭-૦૬-૦૪ના રોજ અબસાડા માંડવી તા. ના ત્રિભેટે આવેલ પોલાડિયા ગામના દોરવાડા નજીક ફંકવામાં આવેલ મરેલ ઢોર નજીક ૩૦૦ ગીધ જોયેલ, જે તેની સારી સંખ્યા છે, તે સૂચ્યવે છે. વળી તા. ૪-૭-૦૪ના ભચાઉ નજીક, લોધેશ્વર ખાતે આવેલ દોરવાડા નજીક ફંકયેલ મૃત ઢોર ઉપર ૨૫ ગીધ જોયેલ.

(૬) નિરનારી ગીધ (Longbilled Vulture)

આ ગીધ પણ અગાઉ કચ્છમાં સામાન્ય હતા. હાલ

તે અસામાન્ય છે. અગાઉ તેમની નોંધ કચ્છમાં મથલ, ભીમાસર, ટાપર, ડોણ તથા છારી હંદ ખાતે થયેલ છે. તે સામાન્ય રીતે સફેદપીઠ ગીધ સાથે હોય છે.

હેલાં ગ્રણ વર્ષ દરમિયાન તેને અબસાડા તાલુકાના વિંગાણ, લખપત તાલુકાના જારા કુંગર, માધાપર નજીક, એડમન્ડ લેક તથા પાલાર ખુના ખાતે જોયેલ છે. તા. ૪-૭-૦૪ના રોજ ભચાઉ પાસે લોધેશ્વર દોરવાડા નજીક બે ગીધ જોયેલા તા. ૨૭-૬-૦૪ના રોજ માંડવી તાલુકાના મરુ ગામમાં ૧૫ ગીધ જોયેલ અને પોલાડિયા દોરવાડા નજીક ૧૦૦ ગીધ જોયેલ, જે તેની સંખ્યા વધે છે તે સૂચ્યવે છે.

ધણાં વર્ષો બાદ, સર્વ પ્રથમ ૧૩-૪-૦૩ અને ૨૬-૪-૦૩ના રોજ તે એડમન્ડ લેક ખાતે બેખડામાં માળા કરતું નોંધાયેલ. તેના દ માળા હતા અને દરેક માળામાં ૧ બચ્ચું હતું. દ પુખ્વાયનાં પક્ષીઓ માળા તથા માળા નજીકે પડેલ. તા. ૨૭-૪-૦૩ના રોજ નખત્રાણા તાલુકાના પાલાર ખુનાની બેખડમાં આ ગીધનો એક માળો જોયેલ, જેમાં એક બચ્ચું નજીકે પડેલ. એક પુખ્વાયનું ગીધ પણ નજીકે પડેલ. વળી તા. ૧૧-૬-૦૪ના રોજ અહીં ફરી પાણું પ્રજનન થયેલ જોવા મળેલ. ૪ બચ્ચાં મોટા થઈ ગયેલા નજીકે પડ્યા સાથે ૧૦ પુખ્વાપક્ષીઓ જોયેલ, જે વારંવાર ખોરાકની શોધમાં જતાં હતાં.

લખપત તાલુકાના જારા કુંગર પર તે પ્રજનન કરતું હોવાની સંભાવના છે, કારણકે, લેખડોમાં અહીં ગીધ જોવા મળે છે. આથી આ ગીધ હવે કચ્છમાં મૂળ સ્થિતિમાં આવતાં હોય તેમ લાગે છે. પણ આ અંગે પૂરી મોજણી કરવાની જરૂર છે.

આમ એકદરે જોઈએ તો કચ્છમાં હવે રાજગીધ, બધામી ગીધ તથા શાહી ગીધની સંખ્યા ઓછી થઈ ગઈ છે. સફેદપીઠ ગીધ અબડાસામાં સારી સંખ્યા ધરાવે છે જ્યારે ગીરનારી ગીધ ફરી પ્રજનન કરતા થયા હોઈ, તેની સંખ્યા વધતી હોય તેમ જણાય છે. આ અંગે હજુ સમગ્ર કચ્છમાં મોજણી કરવાની આવશ્યકતા છે, જેથી સમગ્ર કચ્છમાં ગીધની પરિસ્થિતિનો જ્યાલ આવી શકે.

કચ્છમાં પ્રવર્તમાન ગીધની પરિસ્થિતિની જ્ઞત તપાસમાં મારી સાથે શ્રી. અશ્વિન પોમલ સાથે રહેલ હતા અને આ અંગે તસવીરો પણ તેમણે લીધી હતી.

શાંતિલાલ વડ, ભુજ

* તા. ૬-૪-૦૪ : એક સફેદપીઠ ગીધ અમદાવાદના પાલડી વિસ્તાર ઉપર ઊડતું જોવા મળ્યું.

ધૈવત હાથી, રાજકીય ઝાલા, રાજન જ્ઞાદવ, રાજકોટ

* તા. ૧૦-૮-૦૩ના રોજ મારી વાડીએ ત ગિરનારી ગીધ (Longbilled Vulture) નાળિયેરીના વૃક્ષ પર બેઠેલા જોયા. કયારેક કયારેક આકાશમાં ચકરાવા લેતા નજરે ચેતે છે.

ટિપ્પક જે. ટાકર

મુંદુકશર, તા. માંગરોળ, જુનાગઢ-૩૬૨૨૨૬

* તા. ૧૮-૦૧-૦૪ના રોજ અમે ગિરનારીની બાજુમાં આવેલ દાતાર પર્વતની મુલાકાત લીધી. પર્વતની ટોચથી થોડી નીચે ઉભી કરાડેના પત્થરો ઉપર ત ગિરનારી ગીધ (Longbilled Vulture) જોવા મળ્યાં. સમય સવારનો હતો.

ત્યાં પગથિયાની બાજુમાં જમીન ઉપર એક ઈન્દ્રરાજ (Malabar Whistling Thrush) પણ દેખાયો.

દાતાર પર્વત (જુનાગઢ) ઉપર સફેદપીઠ ગીધ અને ગિરનારી ગીધ નિયમિતપણે દેખાય છે.

જ્ઞાદવ રાજન, ધૈવત હાથી, રાજકીય ઝાલા, રાજકોટ

* મહુવા ખાતે, કૃષિ સંશોધન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટી - મહુવા (જિ. ભાવનગર) ના ખાનાંટેશનમાં ગીધના માળા લીચા નાળિયેરીના વૃક્ષોમાં જોવા મળતાં. આ વૃક્ષો પરથી નાળિયેર ઉતારતી વખતે માળાને પણ છોડવામાં ન આવતા. ગીધ દર વર્ષે માળા બનાવતા નથી, પરંતુ બનાવેલા માળાનો વારંવાર ઉપયોગ કરે છે. આ બાબતે મહુવાની 'ફ્લોરિકન નેચર કલબ'ના ચિરાજ કોટડિયા અને ભાવેશ બાલથિયાએ કરેલ રજૂઆતની નકલ મને મળતા, ગાંધીનગર, કૃષિ મંત્રી અને સચિવના સ્તરે રજૂઆત કરી છે. સહસ્રાંશ વૈજ્ઞાનિક, બાળાયત - મહુવા અને સંશોધન નિયામક - અમદાવાદ શક્ય હોય ત્યાં સુધી માળાવાળા નાળિયેરીના વૃક્ષો પરથી નાળિયેર ન પાડવા જણાવેલ છે, તેમજ સંરક્ષણ માટેના પૂરતાં પગલાં પણ લેવામાં આવશે, તેનું જણાવેલ છે.

અમીત બી. જેઠવા, ખાંબા

* કચ્છમાં ગીધની નોંધ

તા. ૨૭-૦૬-૨૦૦૪: પોલાડિયા (તા. માંડવી)

સફેદપીઠ ગીધ (300), ગિરનારી ગીધ (100); મણ ગિરનારી ગીધ (14).

તા. ૪-૦૭-૨૦૦૪: લોધેશ્વર (તા. ભચાઉ) ખેરા(Scavenger Vulture) (અપરિપક્વ), સફેદપીઠ ગીધ (24), ગિરનારી ગીધ (02).

તા. ૧૧-૦૭-૨૦૦૪: પાલાર ધૂના, (તા. નખત્રાણ), ગિરનારી ગીધ (10) (પુષ્ટ).

શાંતિલાલ વરુ, અંધીન પોમલ, લુઝ

* આપણી ફોન પર થેલી વાત મુજબ આપને સફેદપીઠ ગીધ (Whitebacked Vulture)ના એક જ જાડ પરના ૫ માળા વાળો ફોટો મોકલાવેલ છે. આ જાડ પર આપો દિવસ લગભગ એક સાથે ૧૭ સફેદપીઠ ગીધ જોવા મળે છે. પાંચમાંથી અત્યારે ચારમાં બચ્ચાં છે. એક ખાલી વિખરાઈ ગયેલો માળો છે.

હું તથા પ્રશાંત ચાવડા, તા. ૧-૩-૦૪ના રોજ મોટા ટીબલા (લીભડી) ગયા હતા. ત્યા એક જ જાડ પર ૧૨ સફેદપીઠ ગીધ જોવા હતાં. આ જાડ પર ૬ માળા હતા. આ જાડ ગામતળાવની પાળ ઉપર આવેલું છે. ઇ માળામાંથી બે ખાલી હતા.

તા. ૨૬-૨-૦૪ના રોજ હું, ચિકુવોરા, ફારુક ચૌહાણ વિશાલ થોરિયા તથા પ્રશાંત ચાવડા મેમકા ગામ પાસે ગયા હતા. ત્યા રસ્તામાં ગેબનશાહ પીરની દરગાહ પાસેના તળાવ (બોડા તળાવ)ના એક વૃક્ષ પર સફેદપીઠ ગીધના ચાર માળા હતા. ચારેવામાં એક એક બચ્ચું હતું. આ જાડ પર ૧૭ ગીધ બેઠા હતા. (સાથે આના ફોટો ગ્રાફ આપને મોકલાવીએ છીએ).

૧૧-૨-૦૪ ના રોજ હું, ચિકુવોરા, ફારુક ચૌહાણ, પ્રશાંત ચાવડા તથા વિશાલ થોરિયા વઢવાળાથી લીભડી જતા હતા, ત્યારે વઢવાળામાં ૨૫ સફેદપીઠ ગીધ તથા ૨ ખેરા જોયા હતાં.

યોગેન્દ્ર શાહ, ચિકુવોરા, સુરેન્દ્રનગર

* તા. ૧૬-૨-૦૩ના રોજ ગામ-ધમડકા, તાલુકો-અંજારથી શ્રી અબ્દુલ કરીમ ખત્રીના ફોનથી જણાવ્યા પ્રમાણે તેમણે ૧૬-૨ ના ભચાઉ નજીક, નવા ગામ પાસે, સફેદપીઠ

ગીધ પર જાપતો

ગીધ - ૧૭ જોયા.

અધિકન પોમલ, ઝુજ

* અમે વારંવાર જુનાગઢના ગિરનાર પર્વત ઉપર 'ટ્રેકિંગ' માટે અને પક્ષીનિરીક્ષણ માટે જતા હોઈએ છીએ. ત્યાં સફેદપીઠ ગીધ (Whitebacked Vulture) સહેલાઈ જોવા મળી જાય છે. ક્યારેક ગિરનારી ગીધ (Longbilled Vulture) પણ જોવા મળે છે, પરંતુ રાજગીધ (King Vulture) જોવા મળતું નથી.

તા. ૧૮-૧૦-૦૦ના રોજ ગિરનાર ઉપર બે રાજગીધ જોયા હતા ત્યાર બાદ મને ગિરનાર ઉપર રાજગીધ જોવા મળ્યાં નથી.

તા. ૧૫-૧-૦૩ના રોજ ગિરનાર ઉપર રાણકદેવીના પથ્થરથી આગળ જતાં પહાડની કોતરમાં આવતાં જતાં આઠ સફેદપીઠ ગીધ જોવા મળ્યા. તેના માળા હોય તેવું લાગ્યું. છ થી વધારે ગિરનારી ગીધ ઊડતાં જોવા મળ્યાં. (પહાડની કરાડોમાં ગિરનારી ગીધના માળા હોવાની શક્યતા વધારે છે.- સં.)

તા. ૩-૨-૦૩ના રોજ ગિરનાર ઉપર રાણકદેવીના પથ્થરથી આગળ જતાં પંદરથી વધારે સફેદપીઠ ગીધ ઊડતાં જોયા, સાથે બચ્ચાં હોય તેવું લાગ્યતું હતું.

તા. ૨૦-૨-૦૩ના રોજ ગિરનાર, ભરતવન શૈખાવન તરફથી ઉપર જતા, ૧૫ થી ૨૦ ગીધ ઊડતાં જોયા, પણ ઓળખાઈ શકાયા નથી.

તા. ૩-૭-૦૩ના રોજ મારા મિનો રાજન અને રાજદીપની સાથે જુનાગઢ દાતાર પર્વત જવાનું થયું. ત્યાં સફેદપીઠ ગીધ જોવા મળ્યા.

તા. ૨૭-૧૨-૦૩ના રોજ જામવાળા ગીર પાસે મરેલાં ઢોર પર ચાર સફેદપીઠ ગીધ જોયા. તેના પછીના દિવસે તે ચાર ગીધ તાડના જાડ પર રાતવાસો કરતા જોવા મળ્યા.

તા. ૧૦-૪-૦૪ના રોજ હું, રાજન અને રાજદીપ, છોડવડી ગીરથી બાણેજ જતાં બે રાજગીધ જોયા.

તા. ૧-૧૨-૦૩ના રોજ હું અને ધૈવત સાસડા-ગીર પ્રકૃતિશિક્ષણ શિબિર પૂરી થયા બાદ ટેવળિયા સફારી પાર્કમાં ગયા ત્યારે ત્યાં ૨૦ ખોરા (Scavenger Vulture) જોયા.

તા. ૩-૧૧-૦૩ના રોજ સુરનગર જિલ્લામાં થાન પાસે આવેલા માંડવ વીડમાં, બાડિયા બેલીના મંદિર પાસે એક સફેદપીઠ ગીધ મરેલું જોવા મળ્યું. ત્યારે રાજન, રાજદીપ, ધૈવત પણ સાથે હતા.

આવેશ ત્રિવેદી, રાજકોટ

* રાજકોટમાં જ જ્યુબિલિ બાગ પાસેથી જતો હતો, ત્યાં ક થી ઉ ગીધ ક્રાસ્તાન પાસે ઊડતાં દેખાયા. કાય હતા તે હું ઓળખી શકાયો નથી. પછી જોવા મળ્યા નથી.

વિરેન્ન સંઘવી, રાજકોટ

* કડી શહેરમાં ગીધ અંગેની નિરીક્ષણ નોંધ

અને શહેરની પશ્ચિમે બંધ પદેલ મિલનો ઘણા વિસ્તારમાં ફેલાયેલો નિર્જન વિસ્તાર આવેલ છે. ત્યાં લીમદાનાં ઘણાં જુના, ઊંચા વૃક્ષો હતાં. છેલ્લા દીઠ વર્ષથી તે સ્થળે હું નિયમિત સાંજ-સવાર જતો ત્યારે ૨૭ ગીધની ગણતરી કરતો. ઘણા લીમદા પર માળા પણ હતા. રોજ બપોરે આકાશમાં ગીધને વિહરતાં મેળે જોવા છે. આ બંધ પદેલ મીલનો વિસ્તાર ગીધ માટેનું સરસ આશ્રયસ્થાન હતું.

ગયા માર્ચ-૦૪ માં બંધ થયેલ મિલના પ્રવેશ બાજુએ 'ધરતી સીટી'નું 'બોર્ડ' જોયું. બિલ્ડરો દ્વારા તે જમીન ખરીદ થઈ. ત્યાં 'ધરતી સીટી' રહેણાંકનાં મકાનો તથા દુકાનોની જાહેરાત થઈ અને પડાથડ, ઊંચા-વિશાળ લીમદાનાં વૃક્ષો કપાયાં. ગીધનો આશ્રય વૃક્ષો કપાવાથી નામશોષ થયો. હદ્ધયમાં અનુકૂળ જાગી. હવે આ ગીધ ક્યારે આશ્રય લેશે? થોડા દિવસના નિરીક્ષણ બાદ જ્યાંયું કે આ ગીધોએ અને આવેલ 'રેલવેસ્ટેશન'ની બાજુમાં સરદાર બાગનાં ઊંચાં વૃક્ષોમાં આશ્રય લીધેલ છે. હાલમાં તો ગીધો ત્યાં સલામત હે. ઘટતી જતી ગીધની સંખ્યા પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે.

કડી શહેરની આજુબાજુ આવેલ જળાશયોમાં સફેદ કંકણસાર (White Ibis), કાળી કંકણસાર (Black Ibis), નાની કંકણસાર (Glossy Ibis), નકટા (Comb Duck), ચમચા (Spoonbill), જોવા મળે છે. સમીક્ષાઓની સંખ્યા ઘણી છે. હરિયલ (Green Pigeon) પણ જોવા મળે છે.

અનિલ. જે. પટેલ

આકાશાન, તા. મહેસાના

સારસ વોય



પાછા
બેઠલા

તા. ૨૦-૨-૦૪ : બગોદરાથી તારાપુર જતાં ૨ સારસ ખેતરમાં જોવા મળ્યાં.

તા. ૫-૪-૦૪ : આણંદ બગોદરા રોડ ઉપર બે સારસ ઊડતા દેખાયા.

શૈવત ઢાઢી, રાજકીય જાલા, રાજન જ્ઞાદવ, રાજકોટ

તા. ૧૫-૧૨-૦૪ના રોજ બપોરે ગોડલ, વેરી તળાવમાં સારસ જોવામાં આવ્યું. નિરીક્ષણમાં હું, હિતેખાઈ તથા હરિકૃષ્ણા હતા. રવિવારે બપોરે અમે ફક્ત એક સારસને એક વાડીમાં ફરતું જોયું હતું. થોડી વારે ઊરીને પાડીમાં કુજ (Common Crane) ના ટોળા વચ્ચે જઈ બેઠું. ૪૪ મિનિટ પછી ઊરી ગયું.

ત્યાર પછી, રવિવારે તા. ૨૨-૨-૦૪ના રોજ લગભગ એ જ સમયે પાછું સારસ જોયું હતું.

અણિકેશ એચ. જોધી, ગોડલ

સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના સાલમપુર ગામની સીમમાં માર્યના બીજા પખવાડિયામાં સારસ બેલડી એક બચ્ચા સાથે જોવા મળેલ. આ વિસ્તારમાં ભાગ્યે જ સારસ જોવા મળે છે.

તા. ૧૧-૦૨-૦૪ના રોજ લીલાડી જતાં રસ્તામાં અમે બે સારસ અંકેવાળિયા પાસે જોવા.

થોગેન્ન શાહ, ચિકુવોરા, કુરેઝનજી

તા. ૧૪-૦૧-૦૪ના રોજ સવારે ૮.૦૦ વાગ્યે થોળ જતાં, થોળથી અમદાવાદ તરફ ૪-૫ ક્ર.મી.ના

અંતરે બે સારસ જોવા. થોળથી આવતા પણ તે જ સ્થળે તેઓને જોવા (સમય ૧૧:૩૦).

બૌમિક શાહ, અમદાવાદ

તા. ૦૪-૦૬-૨૦૦૪ના રોજ માતર- પંભાત રોડ ઉપર સારસ ગણતરીનાં ભાગરૂપે હું અને શ્રી સનત શોધન ગયા હતા. ત્યાં અમે ખૂબ જ ચોકસાઈથી ગણતરી કરતાં હુલ ૧૧૭ સારસ એક સાથે જોવા, જેમાં આશરે ૨૫થી ૩૦ અપુખ્નાં પણ સમાવેશ છે. ત્યાર બાદ, તા. ૧૦-૦૬-૨૦૦૪ના રોજ ફરી તે સ્થળની મુલાકાત લીધી ત્યારે આશરે ૭૦ થી ૮૦ નું ટોળું હતું.

મુકેશ આચાર્ય, અમદાવાદ

દસાડા ખાતે પક્ષીનિરીક્ષણ

તા. ૧૩-૬-૦૪નાં રોજ સાંજના સમયે દસાડા પારેના નવા તળાવના કાંઠા પર છ સારસ (બે બચ્ચાં અને પાંચ પુખ્ઝ) તેમજ આશરે ૨૫ મોટાં હંજ (Greater Flamingo) ઉપરાંત, ૫૦ નાની સિસોટી બતક (Lesser Whistling Teal), ૧૦ ટીલિયાળી બતક (Spotbilled Duck), ૧૦૦ થી પણ વધુ કાંઠાપૂંછ ગડેરા (Blacktailed Godwit) અને ૧૦ કલ્યૂત બગલા (Grey Heron) જોવા. પાડી ઘણું ઓદ્ધું હતું.

મુકેશ આચાર્ય, અમદાવાદ

પત-કોતુ

ચકલા ઓછાં છે?

પક્ષીઓ વિષે મારું જ્ઞાન બહુ સીમિત છે પણ થોડીકા રસપ્રદ બાબતો મારા ધ્યાનમાં આવી છે, તે જ્ઞાનું.

અમારા ધરમાં ચકલીઓના માણા છે. થોડા સમય પહેલા અરિસા પાસે કંકુ છંટાયું હોય તેવું લાગ્યું. પછી બબર પડી કે ચકલા અરીસા સાથે જોશનેર ચાંચ મારીને

'યુધ' કરે છે, તેનું આ પરિણામ છે. પછી અમે અરિસા ઢાંડીને રાખવા લાગ્યા. ક્યારેક કાબર કે કાગડો આવી ચઢે તો ચકલા શોર - બકોર કરી મૂકે. જેવા કાબર કાગડાને ભગાડીએ કે શાંતિથી પોતાને કામે વળ્ણે. હમણાં જુનાગઢથી એક બહેન અમારે ત્યાં આવ્યા



હતા. એમણે કહું કે, એમને ત્યાં આસપાસ કયાંય ચકલા જોવા નથી મળતા, ત્યારે આશ્રમ થયું. એમ કેમ હશે?

નાનકડો બગ્ગીયો છે, તેમાં ટચુકરાં પક્ષીઓ, જંગલી કાગડા વગેરે દેખાય, પણ બહુ શરમાળ, તેમને ચણ નાખીએ ત્યાં ભાગી જ્ય.

‘વિહંગ’ વાંચવું ગમે છે. મારી માહિતીમાંથી કંઈ રસપ્રદ લાગે તો સમાવશો.

સુલભા ટેવપુરકર
હર્ષદ ખોટ, પેટેડાઇઝ સિનેમાની બાજુમાં, પોરબંદર-૩૬૦૫૭૫

• ५० •

 ਪੰਚਮਹਾਲਮਾਂ ਹੁੱਸਨੀ ਹਾਜਰੀ

‘વિહંગ’ શિશીર ૨૦૦૪ની આવૃત્તિ નવીન સરનામે મળેલ છે. આભાર!

‘વિહુંગ’, શિશીર ૨૦૦૪ના અંકમાં માનનીય શ્રી લાલસિંહભાઈનો ‘પંખીઓના વ્યાપમાં થતા ફેરફાર’નો લેખ વાંચી, રાજકુંસ તેમજ ગાજહંસના વ્યાપમાં થતા ફેરફાર અંગેની માહિતી જાહી.

ગાજદંસની, પંચમહાલ/દાહોદ જિલ્લામાં હાજરી અંગે જણાવું તો, સને ૧૯૮૪માં પંચમહાલ જિલ્લાના વરખરી (તા. લુકાવડા) ગામના તળાવમાં સૌ પ્રથમ મેં ગાજદંસ ૧૦૦+ જોવા હતા. તે જ વર્ષ પંચમહાલને અરીને આવેલ બાલાશિનોર તાલુકાના વધાસ ગામના તળાવમાં ૨૦૦+ ગાજદંસ જોવા મળેલ હતા. ૧૯૮૪ બાદ તો પંચમહાલ તેમજ દાહોદનાં વિવિધ તળાવો તેમજ તેમાં દર વર્ષ ગાજદંસની હાજરી નોંધાયેલ છે.

રાજહંસ, પંચમાલાની તેમજ દાહોદમાં ભૂતકાળમાં જોવા મળેલ નથી, પરંતુ તારીખ ૮-૦૧-૨૦૦૩ના રોજ દાહોદ જિલ્લાના પાટાંગરી તેમમાં ઉત્ત રાજહંસ જોવા મળેલ. આ બાબતે 'પ્રકૃતિ મિત્ર મંડળ' દાહોદના શ્રી અજય દેસાઈને મેં રાજહંસ જોવા બાબતે જાણ કરેલ હતી. તેઓએ અઠવાડિયા બાદ પાટાંગરી તેમની મુલાકાત લીધેલ, પરંતુ રાજહંસ જોવા મળેલ ન હતા. કદાચ પરતમવાસ દરમિયાન પાટાંગરી તેમની રાજહંસે મુલાકાત લીધેલ હશે.

‘વિહુંગ’ના આ જ અંકમાં નેચર કલબ, સુરતના શ્રી મુકેશ ભાડની માંડવી તાલુકાના આંબલી તેમ પર પાંચ કાળા ઢોક (Black Stork) જોયાની નોંધ વાંચી. આ બાબતે, હું સને ૧૫૮૮માં વાંકલ મુકામે ફરજ બાળપૂરોથે

હતો, તે દરમિયાન આંબલી તેમ પર માંડવીના તે સમયના રેન્જ કોરેસ્ટ ઓફિસર શ્રી તુંગરસિંહજી સૌલકી સાથે પદ્ધતિનિરીક્ષક દરમિયાન બે કાળા ઢોંક જોવા મળેલ હતા.

સુનિલ પુવાર આર.એફ.ઓ
બી-૫૫, સમાનગર, બામરોલી રોડ, ગોપની

સૌરાષ્ટ્રમાં મોટા રાજીલાલની હાજરીનું

આશર્ય!

“વિહંગ” વાંચવાની અને ગુજરાતના જુદાજુદા પક્ષી નિરીક્ષકોના અનુભવો વાંચવા -જાણવાની ખૂબ મજા પડે છે. અમે સમગ્ર પરિવાર, જેમ ચાતક મેઘની પ્રતીક્ષા કરે તેમ “વિહંગ”ની પ્રતીક્ષા કરીએ છીએ. સૌરાષ્ટ્રમાં ભીતીયાળાના જંગલમાં “Scarlet Minivet” જોવા મળ્યો, તેવું શ્રી અઞ્ચલભાઈ બહનું લખાણ વાંચી નવાઈ લાગી સાથે આંનદ થયો કે, સૌરાષ્ટ્ર માં એક નવું પક્ષી નોંધાયું. બીજા કોઈ પક્ષીનિરીક્ષક ભિત્રોએ સૌરાષ્ટ્રમાં અન્ય કોઈ જગ્યાએ જોયો હોય તો માહિતી આપવા વિનંતી.

અમારા ફિલીયામાં હમજાણાં શક્કરખોરા (Purple Sunbird) ખૂબ જ આવે છે. નરના વેરા ભૂરા રંગમાં ખખા (ઉપર બે પીળા ડાઢ) બલ્બલ ખખ સંદર્ભ લાગે છે.

મિત્રવીદા અધ્યયુ
૩૭, વિદ્યુત નગર, સાવર કુંડલા-૩૬૪૫૧૫

અમ્રિત રેમ

શ્રી વિનોદભાઈ નિમાવત લિખિત ‘અમીપુર ટેમ’ વિશેનો લેખ ખૂબ જ રસપદ હતો. તેમની લેખનશૈલીથી હું ખૂબ જ પ્રભાવિત થયો હું. વાચકમિત્રોને આવી લેખનશૈલીથી સ્થળ પર પહોંચાડા બદલ આપ આભારને લાયક તો ખરા સાથે ઘણા બધાનું ટિકિટભાડું પડા બધાયો છો (મજાકનાં અર્થમાં લેવું) ! પરંતુ વર્કન પણ એવું છે કે, ત્યાં ગયા વગર રહેવાય નથી.

મુકેશ આચાર્ય
૧૨. અગ્રણ દેમલેખ તરફાના તથાતી પાત્રે અમદાવાદ-૧૧

ગુજરાતી એટલે મયુરપણી!

મોરબીમાં અમો થોડા મિત્રો શરૂઆતમાં પક્ષીઓને

ચાણ નાખવાનું કરતા. સાથે 'મોર્નિંગવોક' પણ થાય અને દેવર્ધન પણ. આમ 'શ્રી ઈન વન' જોવો હેતુ! સાથે, વૃક્ષારોપણનું લક્ષ પણ ખરું. એમાં ૧૮૮૭માં 'લાયન્સ ઇંગ્લીશ સ્ક્લુલ'માં વૃક્ષારોપણ તથા પર્યાવરણરક્ષા જગ્યાતિનો કાર્યક્રમ તે વખતના નાયબ કલેક્ટર શ્રી પંકજકુમાર જોશી સાહેબની અધ્યક્ષતામાં થયો. તે વખતે મેં મારા વિચારો રજૂ કર્યા કે, બીજા શહેરની જેમ મોરબીમાં પણ મુક્તિ પ્રેમિઓની એક સંસ્થા હોવી જોઈએ. તે પહેલા અમો 'ભાયાવદર નેચર કલબ'નાં ઉપકમે સાસણાં તથા છિગોળગઢ, પક્ષી તથા મુક્તિ દર્શન માટે જતા. ત્રણેક વર્ષ પહેલા બરડાંગરના ભમણ વખતે ભાણવણા 'મુક્તિ જતન પરિવાર'ના ભાઈઓ સાથે હતા. આમાંના ઘણા તો 'વિહંગ'ના સગપણે જાણીતા જ હતા. 'વિહંગ'નું આ

એક જબરું કાર્ય છે.

'મોરબી' મોર પક્ષીની અવિકતા ને લીધે જ નામ પણ છે. પ્રાચીન નામ મોરગઢ, ડેલીનગર, તેમજ મયુરપુરી. મોરબીવાસીઓને મોર માટે ખાસ લગાવ છે, તેથી અમારી સંસ્થા 'મયુર નેચર ચેરીટેબલ ટ્રસ્ટ' અમોએ 'રણસ્ટર' કરાયું. વૃક્ષારોપણ, ખાસ કરને દેશી વૃક્ષો કે જેમાં ફળ લાગતાં હોય તથા ઔદ્યોગિક વૃક્ષોનું વાવેતર કરીએ છીએ. વૃક્ષને પક્ષીની મદદ મળે છે, પક્ષીને વૃક્ષોની જરૂર છે. અવારનવાર મુક્તિ દર્શનના કાર્યક્રમો કરીએ છીએ.

હુર્લબજુ રાઠોડ

કે. ન. મહેન્દ્રપણ, 'રાઠોડ જુવન' મુ. મોરબી
૦૭૯૬૫૦૭૦

મ. કુ. હિંમતક્રિંદલાણી કલામે

વિકસિત દેશોમાં પંખીઓની આદતો તેમની જાસ્તિયતો અને પ્રજનન વળેરેનો ઘણો ઊડો અભ્યાસ થતો રહ્યો છે, જેથી પક્ષીવિજ્ઞાન (Ornithology)-ની શોધો વ્યાપક પ્રમાણમાં થવા પામી છે. તેની સરખામણીમાં આપણા દેશમાં વિહંગો વિરોની માહિતીની ઘડી કિડીઓ ખૂદે છે. વિકિતગત અમુક પક્ષીઓનો છૂટક છૂટક અભ્યાસ થયો છે, પરંતુ તેમાંના કોઈ એકનો સંપૂર્ણ અભ્યાસ થયો હોય, યા એકનિત કરવામાં આવ્યો હોય, તેવું મને હથ સુધી જાણવા મળ્યું નથી. ડૉ. સલીમઅલીએ સુધરી (Baya Weaver)ના પ્રજનનનો સંપૂર્ણ અભ્યાસ કરેલો. તેવી જ રીતે મને ઘ્યાલ છે તે પ્રમાણે, ગુજરાતમાં ચકલી (House Sparrow) નો અભ્યાસ થયો છે. Finn's Baya વિશે પણ ડૉ. સલીમઅલીએ માહિતી મેળવેલી હતી. આ તો ફક્ત અમુક દાખલા દેવા માટે આ ઉલ્લેખ કરી રહ્યો છું. જે કોઈ પક્ષીનો અભ્યાસ હાથ ધરવામાં આવે તેમાં તેની જાસ્તિયતો, દિનયર્થી પ્રજનન અને બચ્યાઉંછેર, એ બધી બાબતોનો વિગતવાર અને ઊડો અભ્યાસ કરવો જરૂરી છે. આ માટે સમય અને સાધનો તેટલી જ અગત્યતા ધરાવે છે. આ બધું હું અહીં લખી રહ્યો હું તેટલું સહેલું નથી!

મારો આ બાબત પોતાનો દાખલો આપું તો, અમુક વર્ષો (૧૯૮૮માં) અગાઉ ભુજથી ઉ કિ. મી. પદ્ધતિમાં



આવેલ એક નાના તળાવમાં મે, મોટી દૂબકી (Great Crested Grebe)ની એક જોડીનો માળો બાંધવાથી માંડી બે બચ્યાં ઊછ્ચી મોટા થયાં, ત્યાં સુધી નિરીક્ષણ કર્યું હતું. આ અભ્યાસ મારા માટે ઘણો જ રસપ્રદ રહ્યો હતો કારણકે, એ તળાવમાં બે જાતના જગતચર પક્ષીઓની પ્રજનનકિયા જોવાનો મને લાભ મળ્યો હતો. અને તે ઉપરાંત, બજે જાતોનો એક બીજા સાથેનો વહેવાર (Interaction) પણ નિદાનવા મળેલો. બીજું પક્ષી હતું, ભગતહું (Common Coot), જે તેના વહેવારમાં ઘણું આક્રમક હોવા ઉપરાંત, દૂબકીના માળાની સણિઓની સતત ચોરી કરતું રહેતું હતું. પરિણામે, મોટી દૂબકીને બે વખત માળાનું સ્થળ બદલવું પડજું હતું. છેવટે ગીજા માળામાં તેને સંપૂર્ણ સફળતા મળી. આ રીતનો અભ્યાસ બને તો દરરોજ અને સૂર્યાદયથી સૂર્યાસ્ત સુધી કરવો જરૂરી છે. પરંતુ હું તેમ કરી ન શક્યો, જે આ રીતના અભ્યાસમાં બામી લેખાય. સૂર્યાસ્ત બાદ પંખીઓનો અભ્યાસ કરવો ન જોઈએ. કારણ કે, તે તેમના રાત્રિના આરામમાં ખેલેલ પહોંચાડે. તે સિવાય, કોઈ માદા માળામાં હીડાં સેવતી હોય, યા નાનાં બચ્યાંને ગરબ રાખવા માટે તેમને પાંખોથી ઢાંકીને બેઠી હોય તો તે મનુષ્યના ડરથી મળો

માસુ. શ્રી હિમતલિંગણી ભલબે

હોડી જાય પછી રાતના અંધારામાં માળામાં પાછી આવી ન શકે અને તેના પરિણામે ઈંડાં ઢરીને ખોટાં થાય અથવા નાનાં બચ્ચાં હોય તો તે ઈંડીમાં બિમાર પડે યા મરણને શરણ થાય. અભલત, નિશાચર પંખીઓ જેવાં કે ધુવડ, ચીભરી, દશરથિયું (Nightjar), વિગેરનો અભ્યાસ કે નિરીક્ષણ રાત્રે જ કરી શકાય. દિવસના ભાગમાં આવાં પંખી ભાગ્યે જ જોવા મળે.

ઉપર જણાવ્યું છે તે મુજબ, મેં એક બીજો અભ્યાસ પણ કરવા કોણિષ્ઠ કરેલ જેનાથી પણ મને પૂર્ણ રીતે સંતોષ થયો ન હતો. તે હતો તેતર (Grey Francolin)નો. તેતરની એક જોડીની માદાએ મારી લુજસ્ટિયત વાડીમાં તેના માળામાં આઈ ઈંડાં મૂક્યા હતાં. માંનું મકાન મારી વાડીની વચ્ચે છે તેથી જ્યારથી ઈંડાંનું સેવન ચાલુ થયું ત્યારથી ૧૮ દિવસે બચ્ચાં નીકળ્યાં ત્યાં સુધી, હું દરરોજ તે માળાનું સવારસાંજ નિરીક્ષણ કરતો. કુલ પાંચ બચ્ચાં હતાં, જેમનું ઈંડાંમાંથી નીકળવાનું એક દિવસ આગાઉ, મોડી સાંજે શરૂ થયું. બધાં બચ્ચાં રાત્રિ દરમિયાન નીકળી આવ્યા હતાં. બીજે દિવસે વહેલી સવારે તેમને જોવા ગયો ત્યારે, તેમની મા તેમને માળામાંથી બહારની તરફ દોડી જતી હતી. તે વખતે નર પણ હાજર હતો. “કુર કુર” અવાજ કરી, પાંખો કુલાવી, મારી સામે આકમક સુદ્રમાં આવ્યો. પરંતુ તેની સાથે તેને મારો ડર પણ લાગતો હોવાથી તે જેટલી જરૂરને સામો થયો તેટલી જ જરૂરથી નીચો નમી આમતેમ ફરતો, માં અને બચ્ચાં તરફ સરકી ગયો! મોટે ભાગે નર તેતર તેના બચ્ચાંને શિકારી પંખીઓથી બચાવવા માટે અદ્ભુત હિમત અને સાહસ દાખવે છે. મેં એકથી વધારે વખત આ રીતનો તેતરનો અભિગમ જોયો છે. જ્યારે શકરાને તેતર જોઈ લે ત્યારે, નર અને માદા ભયસૂચક અવાજો કરે છે અને તે સાંભળી બચ્ચાં વિભેરાઈ જઈ જમીન પર ઘાસ કે ઝાંખરામાં દબાઈ જઈ સંતાતાં હોય છે. જ્યાં સુધી ભયસૂચક અવાજો ચાલુ હોય ત્યાં સુધી સ્થિર થઈ બેસી રહે છે. શકરાની નજર અતિ તેજ હોય છે, તેથી તે ધરતીસરસા દબાઈને બેઠેલા બચ્ચાંને પક્કી લેવા જરૂર મારે છે. તે સમયે નર તેતર, “કિરડિર કુકે” જોરથી અવાજો કરતો જમીન પરથી ઊરીને શિકારી પંખીઓની સામે થાય છે અને આકમદા કરનારે જાડ પર બેસી જવા મજબૂર કરે છે. અમુક વખતે નર તેતર

પીછો કરી તે જ જાડ પર ચડી જતો હોય છે. આ સારીએ પ્રક્રિયા કુદરતમાં એક રોમાંચક દશ્ય ખું કરી દે છે. આમ તેતરની હિન્દુયાના મારા નિરીક્ષણ દરમિયાન શકરાને, તેતરનાં વારાફરતી બે બચ્ચાને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ, બાકી રહેલા તેતરના એ હુંદુંખની દિવસની ગતિવિધિઓ પર નજર રાખવાનું ચાલુ રાખ્યું હતું. બચ્ચાં કંઈક મોટા થયા પછી અને તેમની પાંખો અને પીછાં ઉગ્યા બાદ મેં તેમને એક ચોક્કસ સ્થળે બાજરો ખાવા આપવાનું ચાલુ કર્યું. પહેલા તો તે બાજરો ખાવા, હું દૂર ચાલ્યો જતો ત્યારે જ આવતાં, પણ અમુક દિવસો બાદ એ પંખીઓ મારો વિશ્વાસ કરવા લાગ્યા અને ડરતા નહીં, તેથી હું તેમને સારી રીતે નજીકથી જોઈ શકતો. દરરોજ અને નિયમિત રીતે એ તેતર હુંદુંખને હું જોઈ ન શક્યો એ હડીકત મારે સ્વીકારવી પડે. જો કે સવારે, બપોરે અને સાંજે તેમનું નિરીક્ષણ કરતો રહ્યો, તે છતાં એ અભ્યાસને હું સંતોષકારક તો ન જ કહી શકું. બચ્ચાં પુખ વયના થયા ત્યાં સુધી મેં તેમને જોવાનું ચાલુ રાખ્યું હતું અને તે બાદના વર્ષમાં એ નરમાદાનાં બીજાં બચ્ચાં થયાં ત્યાં સુધી તેમની ગતિવિધિઓ પર નજર રાખેલ. આ સમયે નર પક્ષીએ બે મોટા પુખ વયના સંતાનોને હાંકી કાઢ્યા હતાં.

મારા ઉપરોક્ત અભ્યાસ દરમિયાન મેં જોયું કે, સવારે એ પક્ષીઓનો મોટા ભાગનો સમય ફરવામાં અને ખોરાકની શોધમાં વયીત થતો. બપોરે છાંયડામાં તે આરામ કરતાં અને ત્યાર બાદ, વહેલી સાંજથી ફરી વાર ખોરાકની શોધ ચાલુ થાય. દિવસના ભાગમાં ઘણી વાર પાડેશનાં બીજાં તેતર નજીદીક આવી પહોંચે અને તેમની હદમાં પ્રવેશે તો તેમની સાથે ભારે લડાઈ થતી. મોટા પડકાર અને સતત અવાજો ગૂજી ઉઠતા .આખરે સામો પક્ષ પીછેછાડ કરે અને પછી શાંતિ થાય. સામાન્ય રીતે સવારસાંજ (ખાસ કરીને પ્રજનનઅનુભૂતમાં) સામસામે આ પંખીઓનું બૂલેલવાનું તો ચાલુ જ રહેતું. ખોરાક મેળવ્યા બાદ સાંજના સૂર્યાસ્ત વેળાએ તેતર છોલ્યે પુણમાં ન્યાય અને ત્યાર બાદ પાંખો ખંબેરીને રાતવાસો કરવા, ઊરીને જાડ પર ચડી જાય. આ રીતે કુદરતમાં વિહંગોને નિહાળવામાં જે અત્યંત આનંદ મળે છે, તેનું વર્કન કરવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી.

જ્યુલીલી ગ્રાઉન્ડ, બુઝ ૩૦૦૦૧